## K.Z. LEASING & FINANCE LTD.

REGD. OFFICE: DESHNA CHAMBERS, H/H. KADVA PATIDAR VADI, USMANPURA, ASHRAM ROAD, AHMEDABAD-380014 (GUJARAT) PHONE: 079-27543200 CIN L 65910 GJ 1986 PLC 008864

07thSeptember, 2024

To,
The Deputy Manager,
Department of Corporate Secrvices,
Bombay Stock Exchange Limited
Dalal Street, Fort
Mumbai 400 001.

**BSE Company Code: 511728** 

Dear Sir,

Sub.: Newspaper publication of Notice of AGM, Book Closure and E-voting

It is hereby informed that pursuant toRegulation 30 of SEBI (Listing Obligation and Disclosure Requirements) Regulation, 2015, we herewith enclose the Newspaper Advertisement of Notice of the 38th Annual General meeting of the Company, alongwith details of Book closure and e-voting.

Kindly take note of the same in your record.

Thanking you,

Yours Faithfully,
For, K Z LEASING AND FINANCE LIMITED

ANKIT PRAVINKUMAR PATEL Opinis- ripord by ANUT TRANSMINUS RATI.

ON 14-19, INDIGIO-000-00014; 4-0014001-000410, PARK LYDNUS
UMTARTINA PUT 7-MEKDINANO/THICTU 200014; ANUTORIONALO,
UMTARTINA PUT 7-MEKDINANO/THICTU 200014; ANUTORIONALO,
UMTARTINA
UMTARTINA PUT 7-MEKDINANO/THICTU 200014; ANUTORIONALO,
UMTARTINA
UMTARTINA PUT 7-MEKDINANO/THICTU 200014; ANUTORIONALO,
UMTARTINA PUT 7-MEKDINANO
UMTARTINA PUT 7-

Director, Ankit Patel (Din: 02901371)

Encl: as above

**K.Z. LEASING AND FINANCE LIMITED** Regd. Office: Deshna Chambers, B/h. Kadwa Patidar Wadi, Usmanpur Ashram Road, Ahmedabad - 380014. || CIN: L65910GJ1986PLC00864

NOTICE FOR ANNUAL GENERAL MEETING, BOOK CLOSURE AND E-VOTING

NOTICE FOR ANNUAL GENERAL MEETING, BOOK CLOSUKE AND E-VOTING NOTICE is hereby given that the 38th Annual General Meeting of the Members of K Z Leasing And Finance Limited will be held on Saturday, 28th September, 2024 at 10.00 a.m. at the registered office of the Company at 1st Floor, Deshana Chamber, B/h. Kadva Patidar Wadi, Usmanpura, Ahmedabad -380014, to transact the business set out in the Notice dated 6thSeptember, 2024. The Notice of the 38th AGM and Annual Report for the financial year 2023-24 have been sent by email to all those members of the Company whose email IDs are registered with the Company / Depository Participants. Members desiring to receive the said documents in physical form will continue to get the same in physical form free of cost upon request.

NOTICE is hereby further given that pursuant to Section 91 of the Companies Act, 2013 read with rules made there under and as per Regulation 42 of SEBI (LODR) Regulations, 2015, the Register of Members and the Share Transfer Books of the Company will remain closed from Saturday, 21st September, 2024 to Friday, 27th September, 2024 (both days inclusive), for the purpose of the 38th AGM of the Company. As per the Section 108 of the Rules, 2014 and Regulation 44 of SEBI (LODR) Regulation, 2015, the Company is recycling its perspective for facilities to each their temporary that the section is the company in the provider of the property of the section is the section in the section in the section in the section is the section in the section is the section in the section in the section in the section is the section in the section in the section in the section is the section in the section in the section in the section in the section is the section in the sec

### PUBLIC NOTICE-TENDER CUM E-AUCTION FOR SALE OF SECURED ASSET

[See proviso to Rule 8(6)]
Notice for sale of immovable asset(s)

E-Auction Sale Notice for the sale of immovable asset(s) under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 read with proviso to Rule 8 (6) of the Security Interest (Enforcement) Rules, 2002. This notice is hereby given to the public in general and in particular to the Borrower(s) and Guarantor(s) that the below described immovable property mortgaged/ charged to the Secured Creditor, the physical possession of which has been taken by the Authorised Officer of ICICI Bank Limited will be sold on 'As is where is', 'As is what is' and 'Whatever there is' as per the brief particulars given hereunder;

Sr. No.	Name of Borrower(s)/ Co-Borrowers/ Guarantors/ Loan Account No.	Details of the Secured asset(s) with known encumbrances, if any	Amount Outstanding	Reserve Price Earnest Money Deposit	Date and Time of Property Inspection	Date & Time of E-Auction
(A)	(B)	(C)	(D)	(E)	(F)	(G)
1.	Bhikhubhai Gopalbhai Rampariya (Borrower) Prabhaben Bhikhubhai Rampariya (Co-Borrower) Loan A/c No. LBJAM00004942082	Street No. 04, Main Part- A, Opp. Swaminaran Temple, Near Saibaba Temple, Ranjit Road, City Survey No. 130(130-A-4), Kadijavaj, Lakhani Street No. 4, Jamnagar, Gujarat- 361001. Admeasuring Land area 63.14 Sq. Mtr Free Hold Property	Rs. 33,84,422/- (as on September 05, 2024)	Rs. 7,00, 000/- Rs. 70,000/-	September 11, 2024 11:00 AM To 12:00 Noon	30, 2024 From 11:00 AM

The online auction will be conducted on the website (URL Link- https://disposalhub.com) of our auction agency M/s NexXen Solutions private Limited The Mortgagors/ Noticees are given a last chance to pay the total dues with further interest by September 27, 2024 before 04:00 PM else the secured asset(s) will be sold as per schedule.

The prospective bidder(s) must submit the Earnest Money Deposit (EMD) Demand Draft (DD) (Refer Column E) at ICICI Bank Limited, Solitaire Building, Opposite Church, Indira Gandhi Marg, Jamnagar- 361,008 on or before September 27, 2024 before 03:00 PM Thereafter, they have to submit their offer through the website mentioned above on or before September 27, 2024 before 04:00 PM along with the scanned image of the Bank acknowledged DD towards proof of payment of EMD. In case the prospective bidder(s) is/ are unable to submit his/ her/ their offer through the website, then the signed copy of tender documents may be submitted at ICICI Bank Limited, Solitaire Building, Opposite Church, Indira Gandhi Marg, Jamnagar- 361008 on or before September 27, 2024 before 05:00 PM Earnest Money Deposit DD/PO should be from a Nationalised/ Scheduled Bank in favour of 'ICICI Bank Limited' payable at Jamnagar.

payable at Jamnagar.
For any further clarifications in terms of inspection, Terms and Conditions of the E-Auction or submission of tenders, contact ICICI
Bank Employee Phone No. 7573024297.

Bank Employee Phone No. 75/30/24297. Please note that the Marketing agencies 1. M/s NexXen Solutions Private Limited 2. Augeo Asset Management Private Limited have also been engaged for facilitating the sale of this property. The Authorised Officer reserves the right to reject any or all the bids without furnishing any further reasons.

For detailed Terms and Conditions of the sale, please visit www.icicibank.com/n4p4

Date: September 07, 2024 Place: Rajkot and Jamnaga

STATE BANK OF INDIA DARBARGADH MAHUA BRANCH (60012), MAHUVA, DIST: BHAVNAGAR - 364 290 PH.: +91 02844 222396. Email: sbi.60012@sbi.co.in

Appendix-4 [Rule-8(1)] POSSESSION NOTICE (For Immovable Property)

Authorized Office

Whereas. The undersigned being the Authorised Officer of State Bank of India Darbargadh, Mahuva Branch under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest [Act], 2002 and in exercise of owers conferred upon me under section 13 (12) read with Rule 3 of the Security nterest (Enforcement) Rules 2002, issued a Demand Notice dated 02.05.2024 (duly published in newspaper dated 17-MAY-2024) calling upon the borrower Mr. Suraj Das Prabirbhai to repay the amount mentioned in the notice being Rs. 18,59,990.23 (Rupees Eighteen Lakhs Fifty Nine Thousand Nine Hundred Ninety And Paisa Twenty Three Only) as on 31.03.2024 together with further nterest at the contractual rate on the aforesaid amount together with incidental expenses, costs, charges etc. thereon within 60 days from the date of receipt of the said notice.

The borrower having failed to repay the amount, notice is hereby given to the orrower, legal heirs (known - unknown), legal representatives (known - unknown) uarantor and the public in general that the undersigned has taken Physical Possession of the property described herein below in exercise of powers conferred on me under Section 13(4) of the said [Act] read with Rule 8 of the said rules on this 03rd day of September Of The Year 2024.

The borrower, legal heirs (known - unknown), legal representatives (known inknown), guarantor and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of **State**Bank of India - Darbargadh, Mahuva Branch for an amount of Rs. 18,59,990.23 Rupees Eighteen Lakhs Fifty Nine Thousand Nine Hundred Ninety And Paisa Twenty Three Only) as on 31.03.2024 together with further interest at the contractual rate on the aforesaid amount together with incidental expenses, costs, charges etc. thereon till payment and / or realisation.

The borrower's attention is invited to provision of Sub-Section (8) of Section 13 of the Act, in respect of time available, to redeem the secured assets

#### **Description of Mortgaged property**

All that Piece and Parcel of Property being Residential Building being Plot No. 313E. Admeasuring 82,78 sq.mtr, and construction upon it bearing R. S. No. 321p ituated in Nutan Nagar, Yojna No. 3, Behind Gujarat Society, Mahuva, District: Bhavnagar. Bounded: East by Boundary of Plot No. 313-D, West by Boundary Plot No. 313, North by Boundary of Plot No. 313-B, South by Public Road.

We are withdrawing our Physical Possession Notice dated 11-JULY-2024 & subsequently published in newspaper as on 05-SEPTEMBER-2024 and issuince fresh Paper Publication Notice on 05-SEPTEMBER-2024

Date: 03.09.2024

Place : Mahuva, Bhavnagar State Bank of India - Bhavnagar

RIDDHI CORPORATE SERVICES LIMITED

Regd. Office: 10, Mill Officers Colony, Behind Old RBI, Ashram Road, Ahmedabad GJ -380009 Contact No.: 079-26580767, Email: investor@rcspl.net

Website: www.riddhicorporate.co.in CIN: L74140GJ2010PLC062548

MEETING, BOOK CLOSURE AND REMOTE

**E-VOTING INFORMATION** 

Notice is hereby given that the 13th Annual General Meeting (14th AGM)

of the Members of Riddhi Corporate Services Limited will be held on Saturday, 28th September, 2024 at 11:00 a.m. to transact the business.

as set out in the Notice of the 14th AGM. The Company has sent the Annua

Report along with Notice convening AGM on Friday, 6th September, 2024,

hrough electronic mode to all the Members whose e-mail IDs are registered

with the Company's Registrar & Share Transfer Agent, M/s. Purva Shareregistry (India) Pvt. Ltd. / Depository Participant(s) in accordance

with the Circular issued by the Ministry of Corporate Affairs dated 5th May 2020 read with its circulars dated 8th April, 2020 and 13th April, 2020 and

the Securities and Exchange Board of India circular dated 12th May, 2020. The Annual Report along with the Notice convening the AGM is also

available on the website of the Company at www.riddhicorporate.co.in BSE

Notice is also hereby given that pursuant to the provisions of section 91 of

the Companies Act, 2013; the Register of Members and Share Transfer Books of the Company will remain closed from Sunday 22nd September, 2024 to

Saturday 28th September, 2024 (both the days inclusive) for the purpose o

Pursuant to the provisions of Section 108 of the Act and Rule 20 of the

Companies (Management and Administration) Rules, 2014 as amended

and Regulation 44 of the Securities and Exchange Board of India (Listing

Obligations and Disclosure Requirements) Regulations, 2015, members

are provided with the facility to cast their vote electronically through

e-voting services provided by the CDSL on all resolutions as set forth in

the 14th AGM Notice. The voting rights of the members shall be in proportion to the equity shares held by them in the paid-up equity share

capital of the Company as on Saturday, September, 21, 2024 ('cut-off date')

The remote e-voting period commences on Wednesday, 25th September

2024 at 9.00 a.m. and will end on Friday, 27th September, 2024 at 5.00 p.m

During this period, the Members may cast their vote electronically. The

remote e-voting module shall be disabled by CDSL thereafter. Those

Members, who shall be present in the AGM and had not cast their votes on

the Resolutions through remote e-voting and are otherwise not barred from

doing so, shall be eligible to vote through e-voting system during the AGM.

The manner of remote e-voting and voting at the AGM by members holding

shares in dematerialized mode, physical mode and for members who have not

Any person, who acquires shares of the Company and becomes a Member of

the Company after the Notice has been sent electronically by the Company

and holds shares as on the cut-off date; may obtain the login ID and passwore

by sending a request to helpdesk.evoting@cdslindia.com. However, if he

she is already registered with CDSL for remote e-voting, then he/she can

Members whose email addresses are already registered with the Company

Depositories, may follow the instructions for e-voting during the AGM as provided in the Notice of the AGM. Members whose email addresses are

not registered with the Company/ Depository may follow the below process for registering or updating their email addresses.

Members holding shares in electronic/ Demat form, please update your emai

address with your Depository Participants. However, Members may

emporarily register the same with the Company's Registrar & Share Transfe

Agent i.e. M/s. Purva Shareregistry (India) Pvt. Ltd. at https://

www.purvashare.com/email-and-phone-updation/ on their website

www.purvashare.com/ in the Register your Email id tab by providing details

such as Name, DP ID, Client ID, PAN, mobile number and e-mail address.

In case of any queries pertaining to e-voting members may refer to the

Frequently Asked Questions ("FAQs") and the e-voting manual available a

www.evotingindia.com, under help section or write an email to

For, Riddhi Corporate Services Limited

sd/- Mustafa Mufaddalbhai Sibatra

Company Secretary & Compliance Officer

registered their email addresses is provided in the Notice of the AGM.

use his/her existing User ID and password for casting the votes.

Registration of e-mail addresses:

nelpdesk.evoting@cdslindia.com

Place: Ahmedabad

Date: 06-09-2024

Services (India) Limited (CDSL) at www.evotingindia.com.

14th AGM of the Company.

NOTICE OF THE 14TH ANNUAL GENERAL

vassa Branch, Adivasi Vikas Sangathan Bhavan, Tokarkhada, p.Pioneer Hotel, Silvassa, Dadra Nagar Haveli & Daman and J (U.T.) PIN-396230 Phone: (+91) 0260-2640352 (D) 2642754, mail: silvae@hankofbaroda.com

#### POSSESSION NOTICE (IMMOVABLE PROPERTY)

Whereas, The undersigned being the Authorized Officer of the Bank of Baroda under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement Security Interest Act, 2002 (54 of 2002) and in exercise of Powers conferred unde Section 13(12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued demand notices dated 26-06-2024 calling upon the Borrowers / Guarantor Mortgagor, Mr, Arvind Singh Rameshwar Singh (Borrower), Mr. Rameshwa Singh Bholanath Singh (Co Borrower and Mrs.Geeta Rameshwar Singh (Co Borrower) to repay the amount mentioned in the notice being Rs.4,45,333.23/
(Four Lacs Forty Five Thousand Three Hundred Thirty Three Rupees and Twenty Three Paisa only) + unapplied Interest + Other charges as on 24.06.2024 and interest thereon notice dated 26-06-2024 within 60 days from the date of receipt of the said notice.

The Borrowers having failed to repay the amount, notice is hereby given to the Borrowers and the public in general that the undersigned has taken possessior of the properties described herein below in exercise of powers conferred or nim/her under Sub-Section (4) Section 13 of the said Act read with Rule 8 of the Security Interest Enforcement) Rules, 2002 on this the 02nd day of September of the year 2024.

The Borrowers in particular and the public in general is hereby cautioned not to dea with the properties and any dealings with the properties will be subject to the charge of the Bank of Baroda, Silvassa Branch, Silvassa for an amount of being Rs.4,45,333.23/-(Four Lacs Forty Five Thousand Three Hundred Thirty Three Rupees and Twenty Three Paisa only) + unapplied Interest + Other charges as on 24.06.2024 and further interest & expenses thereon until the full payment.

The borrower's attention is invited to provision of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets

#### **Description of the Immovable Properties**

Equitable mortgage of All piece and parcel of the flat no.211admeasuring 367 Sq fee (carpet area) and 18 Sq feet balcony area, 2nd floor and the building known as SHASHIKALP CLASSIC" constructed on the survey no.7/1/1/1/2 situated at the village Samarvarni Silvassa in the union territory of Dadra and Nagar Havely, The property is in the name of Arvind Singh Rameshwar Singh, Rameshwarsingh Bholanath Singh and Geeta Rameshwar Singh and the property is bounded as under:- North:- Flat No.212 South:- Flat No.210, East:- Passage, West:- Open Land

Sd/- Assistant General Manager & Authorised Office Bank of Baroda, Adivasi Bhavar

#### WARDWIZARD INNOVATIONS & MOBILITY LIMITED

CIN: L35100MH1982PLC264042

Reg. Off.: Office No. 4604, 46th Floor, Kohinoor Square, Kelkar Marg, Shivaji Park, Dadar (West), Nr. R.G. Gadkari Chock, Mumbai - 400028, Maharashtra, India Corp. Off.: Survey 26/2, Opposite Pooja Farm, Sayajipura, Ajwa Road, Vadodara-390019, Gujarat, India | Ph: + 91 63589 99127

E-mail: compliance@wardwizard.in; Website: www.wardwizard.in

RECORD DATE FOR DIVIDEND AND E-VOTING INFORMATION TO THE SHAREHOLDERS

Web link of the Annual Report:

Members holding Equity Shares either in physical form or dematerialized form, as on the cut-off date Monday, 23rd September, 2024 ('cut-off date'), may caste their vote electronically on the business as set forth in the Notice through electronic voting system of Purva Sharegistry (India) Pvt. Ltd.

All the Members are hereby informed:

The business as set forth in the Notice, shall be transacted through remote e-voting an -voting during the AGM,

Remote e-voting start date and time Thursday, 26th September, 2024 at 9.00 A.M.(IST) temote e-voting end date and time Sunday, 29th September, 2024 at 5.00 P.M. (IST)

i. Any person, who acquires Equity Shares of the Company and becomes a Member of the Company after dispatch of the Notice and holding Equity Shares as on the cut off date may btain/generate the login ID and password through the RTA websit

#### 5. Members may note that :

 a) During this period, the Shareholders may cast their vote electronically. The remote e roting module shall be disabled by Purva Sharegistry (India) Pvt. Ltd. beyond 17:00 IST or unday, 29th September, 2024 and once the vote on resolutions are cast and con-

rough VC/OAVM facility and had not east their votes on the Resolutions through remot -voting and are otherwise not barred from doing so, shall be eligible to vote through e oting system during the AGM.

d) A person whose name is recorded in the Register of Member or in the Register of

register/update the same with the Depository Participant with whom they maintain the lemat Accounts and Members holding Shares in physical mode, who have not registered update their email address/Bank account details with the Company, are requested to register/update the same with the Company by sending an e-mail a compliance@wardwizard.in by quoting their Folio Number and attaching a self-attested copy of PAN along with Form ISR-1 in order to facilitate the Company to serve the documents through the electronic mode and to receive copies of the Annual Report 2023 24 along with the Notice, instruction for remote e-voting & e-voting during AGM and

Annual General Meeting (AGM) dated 31st August, 2024 and in particular, instructions for poining the Annual General Meeting (AGM) of the Company, Manner of casting vote through Remote e-voting or e-voting during Annual General Meeting (AGM) of the

Mitematively, Members can update their e-mail address, Mobile No., PAN and Bank Address details along with ISR-1 on the link of RTA as given: https://www.purvashare.com/email-and-phone-updation/.

9. In case of ay query pertaining to e-voting (before/during the AGM), Members can writ

an email to https://evoting.purvashare.com/ or contact at 022-49614132 and 022-49700138. All grievances connected with the facility for voting by electronic means may be addressed to Ms. Deepail Dhuri, Compliance Officer, Purva Sharegistry (India) Private Limited, Unit No. 9, Shiv Shakti Industrial Estate, J. R. Boricha Marg, Lower Parel (East), 49614132 and 022-49700138.

For WARDWIZARD INNOVATIONS & MOBILITY LIMITED

NOTICE IS HEREBY GIVEN THAT:

NOTICE IS HEREBY GIVEN THAT:

1. The Forty Second (42nd) Annual General Meeting (AGM) of the Members of Wardwizard Innovations & Mobility Limited ("the Company") will be held on Monday, 30th September, 2024 at 01.00 P.M. (IST) through Video Conferencing (VC)/Other Audio Visual Means (OAVM)) in compliance with the applicable provisions of the Companies Act, 2013 read with Ministry of Corporate Affairs ("MCA") General Circular Nos. 14/2020 dated 5th May, 2020 and other circulars in this regard, the latest being general Circular No.09/2023 dated 25th September, 2023 and all other applicable circulars, if any, issued by the MCA from time to time and Circular No. SEBI/HO/CFD/CFD-PoD-2I/PCIR/2023/167 dated 7th October, 2023 issued by the Securities and Exchange Board of India ("SEBI") (hereinafter collectively referred to as "the Circulars") vide which, companies are allowed to hold AGMs through VC/OAVM, without the physical presence of members at a common venue. Hence, the 42nd AGM of the Company shall be held through VC/OAVM to transact the business as set forth in the Notice of the 42nd AGM ("The Notice") dated 31st August, 2024. Members participating through the VC/OAVM facility shall be reckoned for the purpose of quorum under Section 103 of the Companies Act, 2023.

2. The remote e-voting facility will be available during the following period

The Cut-off date for determining the eligibility to vote by remote e-voting and/or e-votin system at the AGM shall be Monday, 23rd September, 2024.

ttps://www.purvashare.com/

he Members shall not be allowed to change it subsequently.

c) The Shareholders who have cast their votes by remote e-voting prior to the AGM may also attend/participate in the AGM through VC/OAVM but shall not be entitled to cast their

beneficial Owners maintained by the Depositories as on the cut-off-date shall only be ntitled to avail the facility of remote e-voting and/ or e-voting system at the AGM and for articipation at the AGM shall be **Monday, 23rd September, 2024**.

struction for participation in the AGM though VC.

The manner of voting remotely, for Members holding Shares in dematerialized mode

in the Notice of the AGM. The details are also available on the website of the Compan Scrutinizer: The Company has appointed Mr. Kamal Lalani (Membership no. ACS)

Place: Vadodara Date: 07th September, 2024

NOTICE OF THE 42nd ANNUAL GENERAL MEETING OF THE COMPANY,

2. In Compliance with the aforesaid Circulars, electronic copy of the Notice along with Annual Report for Financial Year 2023-2024 have been sent to all the Members whose amail addresses are registered with the Company/Depository Participant(s)/Company's Registrar & Share Transfer Agent i.e M/s. Purva Sharegistry (India) Pvt. Ltd., ("RTA"). These documents are also available on the website of the Company at www.wardwizard.in, Stock Exchange i.e. BSE Limited at www.bseindia.com and also on be TA website at https://www.wurusebare.com/.a. Agency apointed for the purposed. he RTA website at https://www.purvashare.com/, an Agency appointed for the purpose of conducting Remote e-voting, e-voting during the process of the AGM and VC. The dispatch of Notice of the AGM through emails has been completed on 06th September,

ttps://wardwizard.in/investor-relations/corporate-announcements/annual-report/ nitips://warrdwizaro.in/investor-relations/corporate-announcements/annual-report/

3. Record date for the purpose of Dividend entitlement: Pursuant to Section 91(1) of the Companies Act, 2013 and Regulation 42 of the SEBI, as amended from time to time, the Register of Members and Share Transfer Books for the Equity Shares of the Company shall remain closed from Friday, 20th September, 2024 to Monday, 30th September, 2024 (both days inclusive) in connection with the 42nd AGM and the Company has fixed Friday, 20th September, 2024 as the 'Record Date' for determining entitlement of Members to receive Dividend for the FY 2023-24, if approved at the AGM, subject to the deduction of applicable tax at source ("TDS") as applicable.

A Remote e-voting and e-voting during AGM: Pursuant to the provisions of Section 108 of the Act read with Amended Rule 20 of the Companies (Management and Administration) Amendment Rules, 2015 as amended and Regulation 44 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements). Regulations, 2015, as amended from time to time, the Shareholders are provided with the facility to cast their vote electronically through e-voting services provided by the RTA i.e. Purva Sharegistry (India) Pvt. Ltd. on all resolutions as set forth in the Notice of the Annual General Meeting (AGM).

b) Those Shareholders, who shall be present in the Annual General Meeting (AGM

. Members holding Shares in dematerialized mode, who have not registered/update neir email address/Bank Account Details with their Depository Participants, are requeste

lembers are requested to carefully read all the instructions detailed in the Notice of the

hysical mode and for Members who have not registered their email address, is provided

37774), Practicing Company Secretary, Vadodara, Gujarat as the Scrutinizer to scrutinize the e-voting process in a fair and transparent manner.

Jumbai - 400011 or send an email to https://evoting.purvashare.com/ or contact at 022

By Order of the Board JAYA ASHOK BHARDWA

Company Secretary & Compliance Officer

Any person, who acquires shares of the Company and becomes a Member of the Company after the Notice has been sent electronically by the Company, and holds shares as on the cut-off date; may obtain the login ID and password by sending a request to evoting@nsdl.co.in. However, if he/she is already registered with NSDL for remote e-voting, he/she can use his/her existing User ID and password for casting the

In case of any queries, you may refer the Frequently Asked Questions (FAQs) for Shareholders and e-voting user manual for Shareholders available at the download section of www.evoting.nsdl.com or call on toll free no.: 1800 1020 990 and 1800 22 44 30 or send a request at evoting@nsdl.co.in

Place: Chandigarh Date: September 06, 2024

voting system during the AGM.

Mohinder Singh Company Secretary

Date: September 07,2024

Place: Ahmedabad

Company Secretary & Compliance Officer

Anjali Mukeshbhai Samani

For, V. L. Infraprojects Limited

which are incidental or ancillary to the attainment of its purpose. Provided that the company shall not carryon activities consisting of banking, insurance, venture capital , mutual fund , stock exchange , asset management and other such activities without obtaining inprincipal approval from applicable regulatory authorities. 3. A copy of the draft Memorandum and Articles of Association of the proposed Company may be inspected at the office at 4th Floor,

Form No. URC-2

Advertisement giving notice about registration under Part I of

Chapter XXI of the Act

[Pursuant to section 374(b) of the companies Act, 2013 and rule 4(1)

Notice is hereby given that pursuant to sub-section (2) of section 366 of the Companies Act, 2013, an application is proposed to be made after fifteen days hereof but before the expiry of thirty days

hereinafter to the Registrar at Central Registration Centre (CRC),

Indian Institute of Corporate Affairs (IICA), Plot No. 6, 7, 8, Sector 5

IMT Manesar, District Gurgaon (Haryana), Pin Code-122050, that

VITELY CORP LLP, a LLP may be registered under Part I of Chapter

2. The principal objects of the Company are as follows

The Company shall engage in the business of setting up, operating

running, giving or taking on lease, maintaining and carrying out

other operation of laboratories, research, experiments, tests, diagnose, investigations, facilities or infrastructure for supporting

pharma, biological products, food and other industries or segments

and also to carry out other services, matters, things and activities

XXI of the Companies Act 2013, as a Company Limited by shares.

of the Companies (Authorised to Register) Rules, 2014]

Bodakdev, Ahmedabad-380054, Gujarat. 4. Notice is hereby given that any person objecting to this application may communicate their objection in writing to the Registrar at Central Registration Centre (CRC), Indian Institute of Corporate Affairs (IICA), Plot No. 6, 7, 8, Sector 5, IMT Manesar, District Gurgaon (Haryana), Pin Code-122050, within twenty one

Commerce House II, Opp. Pushparaj Tower Judges Bungalows Road,

days from the date of publication of this notice, with a copy to the Company at its registered office. FOR VITELY CORP LLP

Gira Vijay Patel **Designated Partner** 

Date: 07.09.2024 Place: Ahmedabad

Saheb Bridge, Bopal, Ahmedabad, Gujarat, India, 380058

Ph: (02717) 402494 Website: www.vlil.in Email: info@vlil.in

Vijay Vinod Patel **Designated Partner** 

### V. L. Infraprojects Limited Registered Office: 716, Shivalik Satyamev, Nr. Vakil

NOTICE OF 10" ANNUAL GENERAL MEETING Notice is hereby given that the 10th Annual General Meeting (AGM) V.L.INFRAPROJECTS LIMITED will be held on Monday, September 30, 2024 at 01.30 p.m. through VIDEO CONFERENCING (VC) / OTHER AUDIO VISUAL MEANS (OAVM) in accordance with the applicable provisions of the Companies Act. 2013 and in accordance with the requirements provided in paragraphs 3 and 4 of the MCA General Circular No. 20/2020, The Securities and Exchange Board of India ("SEBI") also vide its Circular No. SEBI Circulars HO/CFD/CFDPoD- 2/P/CIR/2023/167 dated 7th October, 2023 ("SEBI Circular") and all other relevant circulars issued from time to time

Notice calling the AGM without physical presence of members at a common venue. In compliance with above mentioned Circulars, Notice of 10th AGM and Annual Report of the Company for the FY 2023-24, have been sent through electronic mode only to those members who have registered their e-mail id with depositories or with the Company. The Notice of the 10th AGM and Annual Report 2023-24 are also available on the Company's website at www.vlil.in and the Stock Exchange i.e. NSE India (SME Emerge) website at

(collectively referred as "Circulars"), to transact the businesses set out in the

www.nseindia.com and Central Depository Services (India) Limited (CDSL) website at www.evotingindia.com. Instructions for E-voting: The Company has provided its members remote e-voting facility in compliance with the provisions of section 108 of the Companies Act, 2013 and relevant rules made thereunder and Regulation - 44 of the SEBI (LODR) Regulations, 2015. The Company has engaged CDSL as the authorized

agency to provide e-voting facility to its all members. The cut-off date to determine eligibility to cast votes by electronic voting is Monday, September 23, 2024. The remote e-voting facility shall be open for three (3) days, commencing at 9:00 a.m. on Friday, September 27, 2024 and ending at 05:00 p.m. on Sunday, September 29, 2024 for all the members, whether holding shares in physical form or in dematerialized form. Remote e-

The members, who attend AGM through VC/OAVM facility and had not cast their votes on the resolutions through remote e-voting and are otherwise not barred from doing so, shall be eligible to vote through voting facility during the The members may participate in the meeting even after exercising their right

voting facility shall not be allowed beyond the said date and time.

the meeting. Detailed Instruction for remote e-voting facility and voting during the AGM are forming part of the Notice of AGM. Any person who acquires shares and becomes shareholder of the Company after dispatch of the notice and holding shares as of the cut-off date may cast their votes by following the instructions and process of e-voting as provided in

to vote through remote e-voting but shall not be allowed to vote again during

In case of any queries, you may refer the Frequently Asked Questions (FAQs) for Shareholders and e-voting user manual for Shareholders available on www.evotingindia.com or Mr. Rakesh Dalvi, Sr. Manager, (CDSL) Central Depository Services (India) Limited, A Wing, 25th Floor, Marathon Futurex, Mafatlal Mill Compounds, N M Joshi Marg, Lower Parel (East), Mumbai -400013 at e-mail id: helpdesk.evoting@cdslindia.com or call toll free no 1800 21 09911













September, 2024 (both days inclusive), for the purpose of the 38th AGM of the Company, As per the Section 108 of the Rules, 2014 and Regulation 44 of SEBI (LODR) Regulations, 2015, the Company is providing its members the facilities to cast their vote by 'Remote e-voting (i.e. e-voting from a place other than venue of AGM) on all the resolutions set forth in the said Notice. The details as required pursuant to the provisions of the Companies Act, 2013 and Rules made there under are given here under:Companies Act, 2013 and Rules made there under are given below:

1) Date of Completion of dispatch of Notice of AGM: 06th September, 2024 at 9.00 am 3) Date & Time of commencement of Remote e-voting: 25th September, 2024 at 5.00 pm
4) Cut-off date for determining rights of entitlement of Remote e-voting: 21st September, 2024 5) Those persons who have acquired shares and have become members of the Company after dispatch of notice of AGM by the Company and whose names appear in the Register of Members of the Company) in the statement of beneficial owners maintained by depositories as on cutoff date can exercise their voting rights through Remote e-voting shall not be allowed beyond: After 5:00 p.m. on 27th September, 2024 7) Manner of casting vote on resolutions at the venue of AGM: E-voting facility will not be made available at the venue of AGM. E-voting facility will not be made available at the venue of AGM. E-voting facility will not be made available at the venue of AGM. E-voting facility will not be made available on website: www.kzgroup.in

9) Contact details of person responsible to address the grievances connected with remote e-voting or Official. Mr. Rakesh Dalv Designation - Manager, Address: 25th - Address - 25th - 25

9) Contact details of person responsible to address the grievances connected with remote e-voting: Name of Official - Mr. Rakesh Dalvi, Designation - Manager, Address: 25th Floor, A Wing, Marathon Futurex, Mafatlal Mills Compound, NM Joshi Marg, Lower Parel (E), Mumbai - 400 013, Email Id : helpdesk.evoting@cdslindia.com Phone No.: 1800210911
Date: 06/09/2024 By Order of the Board For, K.Z. Leasing & Finance Ltd. Pravinkumar K. Patel (Managing Director)

> Gujarat Pollution Control Board Paryavaran Bhavan, Sector 10 A, Gandhinagar 382 010

Tel 079-23232152 Fax 079-23222784, www.gpcb.gujarat.gov.in Public Notice It is hereby to inform that as per Ministry of Environment, Forest & Climate Change, Government of India, New Delhi vide its Notification no. S.O. 1533 (E) dated September 14, 2006; Public Hearing has been fixed for M/s Axone Chemical LLP for Proposed Expansion of "Synthetic Organic Chemicals" (API) – (1) Flavored Power (Chocolate, Butterscotch, Vanilla, Strawberry) – 50 MT/Month, (2) Formulation of Capsules – 20,00,000 No./Month, (3) Formulation of Tablets - 20,00,000 No./Month, (4) Glimepiride, (5) Nebivolo Hydrochloride, (6) Acebrophylline – (4+5+6) 25 MT/Month and (7) R&D Product – 0.10 MT/Month, At Block No. 328, Plot No. 11,

Sankalp Industrial Estate, Village. Chiyada, Ta. Bavla, Dist Ahmedabad, covered under project category "B" as mentioned in their request application. All local affected persons of the project are requested to remain present in the public hearing or send their response in writing to

Member Secretary, Gujarat Pollution Control Board before the hearing

Other concerned persons having a plausible stake in environment

Report of the project has been sent to the following authorities or

offices to make it available for inspection to the public during norma office hours, till the Public Hearing is over.

District Collector Office, Ahmedabad

Guiarat - 382010.

Ahmedabad.

aspects of the project or activity can submit their responses to Member Secretary, Gujarat Pollution Control Board in writing before the hearing It may be noted that draft Environmental Impact Assessment Report and Executive Summary of the Environment Impact Assessment

. District Development Office, **Ahmedabad**. District Industry Centre, **Ahmedabad**. Taluka Development Office, Ta. Bavla, Dist. Ahmedabad. Regional Officer, Integrated Regional Office, Ministry of Environment, Forests and Climate Change, Room No. 407,

Aranya Bhawan, Near CH-3 Circle, Sector - 10A, Gandhinagar,

Regional Office, Gujarat Pollution Control Board, Ahmedabad

Rural, 1, Daffodils Avenue, Nr. Zydus Research Center, N. H.

No. 8/A, Moraiya-382213, Ta: Sanand, Dist. Ahmedabad.
The District Magistrate /District Collector / Deputy Commissioner or is/her representative not below the rank of an Additional District Magistrate or any other District Level Officer authorized by him/her in this behalf shall supervise and preside over the entire public hearing


(Note:- If a project or activity is confined to the territorial jurisdiction of

one sub-division, the District Magistrate/District Collector/Deputy

Commissioner may alternatively authorize any officer not below the rank of Sub-Divisional Magistrate to supervise and preside over the entire public hearing process).
The Public Hearing is scheduled to be held on 15/10/2024 at 12:00 Hrs, Venue: Plot No. P/2, Kerala Industrial Estate Association

Office Ground, Main Road, Kerala GIDC, Ta. Bavla, Dist:

Considering the present situation of pandemic of Covid-19 all



SURANI STEEL TUBES LIMITED CIN: L27109GJ2012PLC071373
Regd. Off: S. No.110,115, Opp. Vinayak TMT, Bayad Road, Tal. Dahegan
Gandhinagar, Sampa, Gujarat, India, 382315, Tel: 9501347722
E-mail: cs@suranisteel.com, Website: www.suranisteel.com, NOTICE OF 12TH ANNUAL GENERAL MEETING (AGM) AND REMOTE E-VOTING NOTICE is hereby given that the 12th Annual General Meeting ("AGM") of Members of Surani Steel Tubes Limited will be held on Saturday, September 28, 2024 at 11:00 A.M. through Video Conference ("VC") / Other Audio Visual Means ("OAVM") to

transact the businesses, as set out in the Notice convening AGM. The Company has

dispatched the Notice convening AGM, through electronic mode on Friday, Septembe

06, 2024 to the members whose email addresses are registered with the Company

D. M. Thaker

Member Secretary

and/or Depositories in accordance with the various Circular issued by the Ministry of Corporate Affairs and Securities and Exchange Board of India. The Notice convening the AGM are available on the web- site of the Company at www.suranisteel.com and on the website of National Securities Depository Limited ("NSDL") at

Remote E-Voting and Voting during the AGM

www.evoting.nsdl.com

voting"). Detailed procedure for remote e-voting/e-voting is provided in the Notice of the ursuant to the provisions of Section 108 of the Act and Rule 20 of the Compa (Management and Administration) Rules, 2014, as amended and Regulation 44 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the Members are provided with the facility to cast their votes on all resolutions as set forth in the Notice convening the AGM using e-voting facility provided by NSDL.

The Company has fixed Saturday, September 21, 2024 as the cut-off date for

ascertaining the names of the shareholders holding shares either in physical form or

in dematerialised form, who will be entitled to cast their votes electronically in respect of

The Company is providing remote e-voting facility ("remote e-voting") to all its members to cast their votes on all resolutions as set out in the Notice of AGM. Additionally, the

Company is providing the facility of voting through e-voting system during the AGM ("e-

isinesses to be transacted as per the Notice of AGM and to attend the AGM. The voting rights of Members shall be in proportion to the equity shares held by them in the paid-up equity share capital of the Company as on Saturday, September 21, 2024 ("cutoff date"). The remote e-voting period commences on Wednesday, September 25, 2024 at 9.00 A.M. and will end on Friday, September 27, 2024 at 5.00 P.M. During this period the Members may cast their vote electronically. The remote e-voting module shall be disabled by NSDL thereafter. Those Members, who shall be present in the AGM through

VC/OAVM facility and had not cast their votes on the Resolutions through remote e-

voting and are otherwise not barred from doing so, shall be eligible to vote through e

The Members who have cast their votes by remote e-voting prior to the AGM may also

attend/participate in the AGM through VC/OAVM but shall not be entitled to cast their The Board has appointed Mr. Sahil Malhotra, Practicing Company Secretary as scrutinizer to scrutinize the voting entire e-voting process in a fair and tran-

For Surani Steel Tubes Limited



હરિયાણા વિધાનસભાની ચૂંટણી પૂર્વે શુક્રવારે ઓલિમ્પિયન રેસલર વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા નવી દિલ્હીમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને મળ્યા હતા. અને કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી કેસી વેશુગોપાલ પ્રવકતા પવન ખેરા હરિયાણા કોંગ્રેસ પ્રમુખ ઉદયભાન તથા પ્રભારી દીપક બાબરિયાની હાજરીમાં કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા.

### ઉત્તરપ્રદેશમાં ભયાનક માર્ગ અકસ્માત

# ૩૦ પ્રવાસીઓ સાથેનો ટેમ્પો બસ સાથે અથડાતા ૧૫નાં મોત્

સર્જાયો છે. અહીં ૩૦ મુસાફરોને લઈ જઈ રહેલો લોડર ટેમ્પો અને બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં ૧૫ લોકોના મોત થયા છે. જયારે મૃત્યુઆંક વધવાની પણ સંભાવના વ્યક્ત ૧૨ લોકો ઈજાગ્રસ્ત થયા છે, આવ્યા છે.

લોડર ટેમ્પોમાં લગભગ ૩૦

આજે શુક્રવારે એક મોટું નિવેદન

આપ્યું છે. જેમાં રાજનાથ સિંહે કહ્યું

છે કે, "ભારતે હંમેશા શાંતિની

હિમાયત કરી છે ભારત હંમેશાથી

વિશ્વમાં ભારત એકમાત્ર એવો

દેશ છે જેણે 'વસુધૈવ કુટુંબકમ'નો

સંદેશ આપ્યો છે. વર્તમાન વૈશ્વિક

ભૌગોલિક રાજકીય પરિસ્થિતિને

જોતા મેં સેના કમાન્ડરોને કહ્યું કે

શાંતિનો ઉપાસક રહ્યો છે, હતો

અને રહેશે.

ભારતે હંમેશા શાંતિની

હિમાયત કરી છે : રક્ષામંત્રી

કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહે રાખવા માટે આપણે હંમેશા યુદ્ધ

કેન્દ્ર સરકાર દ્વારા ૫૦ ટકા

રાહતદરે ડુંગળીનું વેચાણ શરૂ

ડુંગળીના વધતા ભાવોને સ્પેશિયલ વાન મારફત ૩૫

અંકુશમાં લેવા હવે સરકાર રૂપિયે કિલોના ભાવે ડુંગળી

મેદાનમાં ઉતરી છે. છેલ્લા એક વેચવામાં આવી રહી છે. હાલ

વર્ષમાં ડુંગળીના ભાવો ૫૦થી દિલ્હી અને મુંબઈમાં ડુંગળીના

૬૦ ટકા વધ્યા છે. આ ભાવો પર વેચાણ શરૂ કરશે. નાફેડ અને

નિયંત્રણ લાદતાં તેમજ એનસીસીએફ સરકારનો ૪.૭

ગુહિણીઓને આર્થિક ટેકો કરતાં લાખ ટન ડુંગળીનો બફર સ્ટોક

નેશનલ કોઓપરેટિવ વાન મારફત દિલ્હી-

કન્ઝ્યુમર્સફેડરેશન અને નેશનલ એનસીઆરના ૩૮ રિટેલ

એગ્રિકલ્ચર કો-ઓપરેટિવ સ્થળો, મુંબઈમાં પરેલ અને

માર્કેટિંગ ફેડરેડશન (નાફેડ) મલાડ ખાતે વેચાણ કરશે.

કેન્દ્ર સરકારે સસ્તા દરે ડુંગળી મેનેજ કરી રહી છે.

વેચવાનું શરૂ કર્યું છે.

નવી દિલ્હી, તા.૬ દ્વારા દેશના જુદા-જુદા સ્થળોએ

આવે.'

નવી દિલ્હી,તા. ૬ ભારત અને વિશ્વમાં શાંતિ જાળવી

#### ૧૫ લોકો ઈજાગ્રસ્ત : મૃત્યુઆંક વધવાની આશંકા રાષ્ટ્રપતિ-વડાપ્રધાને મૃતકોના પરિજનોને સંવેદના પાઠવી

મળતા અહેવાલો મુજબ અને મહિલાઓ પણ સામેલ છે. વ્યક્ત કરી છે. પોલીસ અધીક્ષક નિપુલ

માટે તૈયાર રહેવું જોઈએ, જેથી

કરીને કોઈ પણ સંજોગોમાં આપણી શાંતિને ખલેલ પહોંચાડવામાં ન

આ પહેલા ગુરુવારે લખનઉમાં

આર્મી કમાન્ડર્સની કોન્ફરન્સને

સંબોધિત કરતી વખતે રાજનાથ

સિંહે રશિયા-યુક્રેન અને

ઈઝરાયેલ-હમાસ સંઘર્ષ અને

બાંગ્લાદેશની વર્તમાન સ્થિતિનો

જે તેના સ્ટોર અને મોબાઈલ

ઉલ્લેખ કર્યો હતો.

ઉત્તર પ્રદેશના હાથરસમાં મુસાફરો મુકુંદ ખેડીમાં તેરમામાં ભોગ બનેલા તમામ લોકો શુક્રવારે સાંજે ભયાનક અકસ્માત ગયા હતા અને ત્યાંથી ખંદૌલીના સાસનીથી ખંદૌલી આવી રહ્યા ગંભીર છે અને તેઓને હાયર સેન્ટરમાં ખસેડવામાં આવ્યા છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, કરવામાં આવી છે. આ ઘટનામાં સેવલા ગામમાં પરત ફરી રહ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ્હતા. આ દરમિયાન આગરા- મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જેમને સારવાર માટે નજીકની અલીગઢ બાયપાસ પાસેના આ ભયાનક અકસ્માત અંગે હોસ્પિટમાં દાખલ કરવામાં મીતઈ ગાંવ પાસે અકસ્માત દુઃખ વ્યક્ત કરી મૃતકોના સર્જાયો હતો. મૃતકોમાં બાળકો પરિવારજનો પ્રત્યે સંવેદના

હતા. હાલ ડ્રાઈવરની ધરપકડની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઈજાગ્રસ્તોમાં ચારની સ્થિતિ છે. અમેરિકાની ચૂંટણીમાં

#### નામ બદલેલ છે

નારૂ જુનુ નામ મનસુરી મહમદઆસીફ અબ્દુલમજીદ થી બદલી નવુ નામ મનસુરી મોંહમદઆસીફ રાખેલ છે. ૧૭૬/૧૦૯૧, ગુજરાત હાઉસીંગ બોર્ડ, જનરલ હોસ્પીટલ સામે, બાપુનગર, અમદાવાદ

#### -ઃ જાહેર નોટીસ ઃ-નગર રચના યોજના નં.૯૦

#### (સરખેજ-ઓકાફ-ફતેવાડી-મકરબા) (આખરી યોજના)

હું નગર રચના અધિકારી, નગર રચના યોજના નં.૯૦ (સરખેજ-ઓકાફ-ફ્લેવાડી-મકરબા) યોજના વિસ્તારના તમા ર્વીન માલિકો હિત સંબંધ પરાવતી વ્યક્તિઓને અથી જણાસું છું કે અનેથી અંતિમ યોજનામાં ઉપલબ્ધ રે કર્કના આધારે મુળખંડન મત તથા અંતિમખંડની કિંમત તથા અંતિમખંડની અવિકસિત તથા વિકસિત કિંમતો નક્કી કરી કામચલાઉ મુલ્યાંકનની દરખાસ્ત યાર કરાયેલ છે. જે અન્વયે તમામ જમીનમાલિકોને તેની જાણ કરતી નોટીસો બજાવવામાં આવેલ છે. તેમ છતાં એક યા અ ારસો સર નોડીસ મળેલ ન હોય તો આ નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન- જ્યાં કચેરી સમય દરમ્યાન જાહેર રજાના દિવસો સિવા દેવસે દસ્તાવેજી પુરાવા સાથે નીચેના સરનામે આપશ્રી અથવા આપના પ્રતિનિધિ હાજર રહી ઉપરોક્ત યોજનાની કામચલ હુવ્યાં કત્તની દરખાસ્તોની સમજણ મેળવી જવા તેમજ તે અન્વયે કોઈ રજુઆત હોય તો લેખિત રજુઆત કરવા વિનંતી કરવામ

નગર રચના અધિકારી નગરનિયોજક-૩ અમદાવાદનગર સ્થના યોજના એકમ-૨,

**કચેરીનું સરનામું** :-નગર રચના અધિકારી, નગર નિયો*જક*-૩, પવર નગર નિયોજકશ્રીની કચેરી, બમદાવાદ નગર રચના યોજના એકમ-૨, અમદાવાદ ત્રીજો માળા, ઓફીસ નં.૩૧૭ થી ૩૨૨, મહ્ટીલેવલ પાર્કિંગ એન્ડ કોમર્શિયલ કોમ્પલેક્ષ નવરંગપુરા બસ સ્ટેન્ડની પાછળ, નવરંગપુરા, અમદાવાદ-૩૮૦૦૦૯ ક્રમાંક/સંમાનિ/અમદ/૫૭૯/૨૦૨૪



#### ટોરેન્ટ પાવર લિમિટેડ નોટીસ

પ્રાહકોને ગુજાવત્તાભર્યો અને વિશ્વસનીય વીજપૂરવઠો સતત અને સુનિશ્ચિતપણે મળતો રહે તે માટે નેટવ*ર્ક* મેઇનટેનન્સનું આયોજન કરેલ છે. નીચે દર્શાવેલ સબસ્ટેશનો/પોલ માઉન્ટેન્ડ ટ્રાન્સફોર્મરમાંથી વીજપૂરવઠો મેળવતા ગ્રાહકોનો સવારના ૧૦ઃ૦૦ થી સાંજના પઃ૦૦ ક્લાક દરમ્યાન વીજપૂરવઠો બંધ થવાની શક્યતા છે. આપની

<u>તા.૦૯/૦૯/૨૦૨૪, સોમવાર</u> (૧) <u>જી.આઇ.ડી.સી. વટવા ફ્રેઝ-૧ઃ</u> શ્રીમ ઇન્ડસ્ટ્રીઝ-SS, શીતલ એન્ટરપ્રાાઇઝ-PMT, મન્ના (MANNA)-SS, (૨) <u>ગુજરાત કોલેજઃ</u> શૈવલ પ્લાઝા-PMT, (૩) <u>સંદેશ</u> <u>પ્રેસ રોડઃ</u> વિનસ ટાવર-SS, (૪) <u>ઇસકોન થી બોપલ રોડ</u>ઃ અર્થ-૧૨-TR-૧, (૫) <u>શિવરંજની</u>ઃ વિમાનગર-SS, (ε) જુ<u>હાપુરાઃ</u> અક્ઝલ ટાવર-SS, (૭) <u>એસ.જી. હાઇવે, થલતેજઃ</u> એનિગ્મા, (૮) <u>અખબાર નગરઃ</u> ડ્રીમ સ્ક્વેર-SS-TR-૧, (૯) <u>ગાંધીનગર</u>ઃ વાલ્મી, (૧૦) <u>નિકોલ ગામ રોડ</u>ઃ અક્ષર વિલા-TR, યોગેશ્વર (નિકોલ)-TR-૧, (૧૧) <u>નિકોલ કેનાલ</u>ઃ સાર્થક એવેન્યુ-TR, (૧૨) <u>કેન્ટોનમેન્ટ</u>: એમઇએસ હોસ્પિટલ (ગેરીસન. એન્જી.)-MES-HT, (૧૩) <u>રબારી કોલોની</u> <u>નેશનલ હાઇવે:</u> હરભોલેનાથ-SS. <u>તા.૧૦/૦૯/૨૦૨૪, મંગળવાર</u> (૧) <u>જી.આઇ.ડી.સી. વટવા</u> <u>ક્રેઝ-૧:</u> કૈલાશ નગર (PH-૧ VATWA)-SS, (૨) <u>જી.આઇ.ડી.સી. વટવા ફ્રેઝ-૪:</u> ઉમા-SS, પ્લોટ નં.૩૪૧૦-SS, કોલારાન્ટ-PAD, (૩) એસ.જી. હાઇવે સોલાઃ ભગવત પેટ્રોલ પંપ-PMT, (૪) <u>મહાલક્ષ્મી ચાર રસ્તાઃ</u> દેવનંદન-૨-SS, (૫) <u>ઇસકોન શ્રી થલતેજ હાઇવે</u>ઃ પી વી એન્કલેવ-CSS, ( દ) <u>વેજલપુર રેલ્વે ક્રોસીંગ:</u> ઔડા આવાસ યોજના (વેજલપુર)-SS, (૭) <u>ઘાટલોડીયા:</u> શ્યામ રત્ન, (૮) <u>ચેનપુર:</u> શુકન હોમ ચેનપુર, (૯) <u>ચાંદલોડીયા:</u> કિર્તિ ટેનામેન્ટ, (૧૦) <u>રિલીફ રોડ પથ્થર કુવા:</u> જૂમસન ચેમ્બર્સ-SS, (૧૧) મેઘાશીનગરઃ ગોવર્ધન એન્ક્લેવ-TR, (૧૨) નિકોલ ગામ રોડઃ સુર્ય

અસુવિધા બદલ દિલગીર છીએ

**K.Z. LEASING AND FINANCE LIMITED** Regd. Office: Deshna Chambers, B/h. Kadwa Patidar Wadi, Usmanpura Ashram Road, Ahmedabad - 380014. || CIN: L65910GJ1986PLC00864

NOTICE FOR ANNUAL GENERAL MEETING, BOOK CLOSURE AND E-VOTING

NOTICE is hereby given that the 38th Annual General Meeting of the Members of K Z Leasing And Finance Limited will be held on Saturday, 28th September, 2024 at 10.00 a.m. at the registered office of the Company at 1st Floor, Deshana Chamber, B/h. Kadva Patidar Wadi, Usmanpura, Ahmedabad -380014, to transact

the business set out in the Notice dated 6thSeptember, 2024.

The Notice of the 38th AGM and Annual Report for the financial year 2023-24 have been sent by email to all those members of the Company whose email IDs are registered with the Company / Depository Participants. Members desiring to receive the said documents in physical form will continue to get the same in physical form free of cost upon request.

NOTICE is hereby further given that pursuant to Section 91 of the Companies Act, 2013 read with rules made there under and as per Regulation 42 of SEBI (LODR) Regulations, 2015, the Register of Members and the Share Transfer Books of the Company will remain closed from Saturday 21st September, 2024 to Fiday 27th

Regulations, 2015, the Register of Members and the Share Transfer Books of the Company will remain closed from Saturday, 21st September, 2024 to Friday, 27th September, 2024 (both days inclusive), for the purpose of the 38th AGM of the Company. As per the Section 108 of the Rules, 2014 and Regulation 44 of SEBI (LODR) Regulations, 2015, the Company is providing its members the facilities to cast their vote by 'Remote e-voting' (i.e. e-voting from a place other than venue of AGM) on all the resolutions set forth in the said Notice. The details as required pursuant to the provisions of the Companies Act, 2013 and Rules made there under are given here under: Companies Act, 2013 and Rules made there under are given below:

Date of Completion of dispatch of Notice of AGM: 06th September, 2024
Date & Time of commencement of Remote e-voting: 25th September, 2024 at 9.00 am
Date & Time of end of Remote e-voting: 27th September, 2024 at 5.00 pm
Cut-off date for determining rights of entitlement of Remote e-voting: 21st September, 2024

4) Cut-off date for determining rights of entitlement of Remote e-voting: 21st September, 2024. 5) Those persons who have acquired shares and have become members of the Company after dispatch of notice of AGM by the Company and whose names appear in the Register of Members of the Company in the statement of beneficial owners maintained by depositories as on cutoff date can exercise their voting rights through Remote e-voting by following the procedure as mentioned in the said Notice of AGM 6) Remote e-voting shall not be allowed beyond: After 5:00 p.m. on 27th September, 2024 7) Manner of casting vote on resolutions at the venue of AGM. The facility of voting through 'Ballot Paper' shall be made available at the venue of AGM. E-voting facility will not be made available at the venue of AGM. Members who have already cast their vote by remote e-voting prior to the AGM can attend the AGM but shall not be entitled.

will not be made a valiable at the venue of AGM. Members who have already cast their vote by remote e-voting prior to the AGM can attend the AGM but shall not be entitled to cast their vote again at AGM.

8) Notice of 38th AGM is available on website: www.kzgroup.in

9) Contact details of person responsible to address the grievances connected with remote e-voting: Name of Official-Mr. Rakesh Dalvi, Designation - Manager, Address: 25th Floor, A Wing, Marathon Futurex, Mafatlal Mills Compound, NM Joshi Marg, Lower Parel (E), Murphi 400,013. Email (d. beldetek, existing/ediplicing proposed).

Mumbai - 400 013, Email Id : helpdesk.evoting@cdslindia.com Phone No. : 180021091

By Order of the Board For, K.Z. Leasing & Finance Ltd Pravinkumar K. Patel (Managing Director)

the business set out in the Notice dated 6thSeptember, 2024.

#### સપ્ટેમ્બર ૨૦૨૪ દરમિયાન

## ભારતે એમએસસીઆઈ ઈએમ ઈન્ડેક્સમાં ચીનને પાછળ છોડ્યુ

નવી દિલ્હી, તા. ૬ ઈન્ડેક્સ (સ્ટાન્ડર્ડ ઈન્ડેક્સ) મોટા સપ્ટેમ્બર-૨૦૨૪ દરમિયાન, અને મિડકેપ સ્પેસને આવરી લે છે, એ મએ સસીઆઈ

૨૨.૨૭ ટકા રહ્યું છે.

કેપિટલાઈઝેશનના લગભગ ૮૫ ભારતીય કોર્પોરેટ્સના મજબૂત ટકા કવરેજનું લક્ષ્ય રાખે છે.

મોર્ગન સ્ટેનલીએ જાહેરાત કરી હતી જયારે આઈએ મઆઈમાં વધુ કે ભારતે એમએસસીઆઈ ઈમર્જિંગ \_ વ્યાપક રેન્જનો સમાવેશ થાય છે, માર્કેટ્સ ઈન્વેસ્ટેબલ માર્કેટ ઈન્ડેક્સ જેમાં લાર્જ, મિડ અને સ્મોલ કેપ (એમએસસીઆઈ ઈએમ શેરોનો સમાવેશ થાય છે. આઈએમઆઈ)માં તેના વજનની અેમ.એ ૨ા.૨ાી.આ ઈ. દ્રષ્ટિએચીનને પાછળછોડી દીધું છે. આઈ.એમ.આઈ.માંચીનની ઈએમ સરખામણીમાં ભારતનું ભારે આઈએમઆઈમાં ભારતનું પ્રભુત્વ પ્રભુત્વ તેની બાસ્કેટમાં રહેલા મોટા ચીનના ૨૧.૫૮ ટકાની તુલનામાં સ્મોલ-કેપ વેઈટિંગને કારણે પેદા થાય છે. ચીનમાં આર્થિક મંદીના એ મએ સારાીઆ ાઈ પગલેચીનના બજારો સંઘર્ષ કરી આઈએમઆઈમાં ૩,૩૫૫ શેરો છે રહ્યા છે, ત્યારે ભારતના બજારોને અને તેમાં મોટી, મિડ અને સ્મોલ અનુકૂળ મેક્રોઈકોનો મિક કેપ કંપનીઓનો સમાવેશ થાય છે. પરિસ્થિતિઓનો લાભ મળ્યો છે. તે ૨૪ ઈમર્જિંગ માર્કેટ્સ દેશોના તાજેતરના ભૂતકાળમાં, ભારતે શેરોને કબજે કરે છે અને દરેક દેશમાં ભારતીય અર્થતાંત્રના મજબૂત ફ્રી ફ્લોટ એડજસ્ટેડ માર્કેટ મેક્રોઈકોનોમિક ફંડામેન્ટલ્સ તેમજ દેખાવથી પ્રેરિત ઈક્વિટી માર્કેટની મુખ્ય એમએસસીઆઈ ઈએમ ઘણી શ્રેષ્ઠ કામગીરી નોંધાવી છે.

## પુટિને કમલા હેરિસના હાસ્યના પણ વખાણ કર્યા

# અમેરિકાની ચૂંટણીમાં પુટિને કમલા હેરિસને સપોર્ટ જાહેર કર્યો

પુટિન માઈન્ડ ગેમ રમતા

હોય તેવું લાગે છે કારણ કે

ગુંચવણ પેદા થઈ થઈ શકે છે

ઉડાવી છે. એક ક્વેશ્વન આન્સર

સેશનમાં તેમણે કહ્યું કે અમે કમલા

હેરિસને ટેકો આપવાના છીએ.

અમેરિકાની ચૂંટણી પર આખી અમેરિકાના પ્રેસિડન્ટ હતા ત્યારે કરીને કહ્યું કે મને આશા છે કે દુનિયાની નજર છે ત્યારે રશિયાને તે મણે રશિયા પ૨ આકરા હેરિસ સારો દેખાવ કરશે તો કદાચ સ્વભાવિક છે. રશિયાના પ્રેસિડન્ટ ઝાટકણી કાઢી હતી. વ્લાદિમીર પુટિને આશ્ચર્યજનક વાત કરીને કહ્યું છે કે તેઓ અમેરિકન રાજકારણની હાંસી અમેરિકામાં કમલા હેરિસ પ્રેસિડન્ટ બને તે વધુ પસંદ કરશે. રશિયાના પ્રેસિડેન્ટ કમલા હેરિસને સીધે સીધો ટેકો આપે તે આવી ટિપ્પણીથી અમેરિકામાં એક પ્રકારની માઈન્ડ ગેમ હોય તેવું લાગે છે કારણ કે તેનાથી અમેરિકાના વોટર્સ ગૂંચવાઈ જશે. અમેરિકા અને રશિયા વચ્ચે અત્યારે જોરદાર દુશ્મની ચાલે છે ત્યારે રશિયાના પ્રેસિડન્ટ જેને ટેકો જાહેર કરતા હોય તે વ્યક્તિને વોટ અપાય કે નહીં તેવો સવાલ પેદા થશે.જોકે, કેજીબીના ભૃતપૂર્વ એજન્ટ રહેલા પુટિન આવી માઈન્ડ ગેમ ખેલવામાં માહેર છે અને તેમનો ઈરાદો કંઈક અલગ

કિંપની અધિનિયમ, ૨૦૧૩ ની ક્લમ ૩૯૪(બ) અને કંપનીઓ (નોંધણી માટે જ હોઈ શકે છે. રશિયન ઈસ્ટર્ન અધિકૃત) નિયમો, ૨૦૧૪ ના નિયમ ૪(૧) અનુસાર] ઈકોનોમિક ફોરમમાં પુટિને કહ્યું ૧.આથી નોટિસ આપવામાં આવે છે કે, કંપનીઓ અધિનિયમ, ૨૦૧૩ ની ક્લમ કે તેઓ કમલા હેરિસને સપોર્ટ કરે

૩૬૬(૨)ના પેટા વિભાગ (૨) અનુસાર, આ સૂચનાના પ્રકાશન પછી ૧૫ દિવસ બાદ પરંતુ ૩૦ દિવસના ગાળાની પૂર્તિ પહેલા, નોંધણી અધિકારીને સેન્ટ્રલ રજીસ્ટ્રેશન સેન્ટર (સીઆરસી), ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોર્પોરેટ અફેરસ (IICA), પ્લોટ નં. ૬, ७, ८, રશિયાની દખલગીરીના આરોપો રાશયાની દખલગારીના આરોપો ક્ષેક્ટર ૫, IMT માનેસર, જિલ્લા ગુડગાંવ (હરિયાણા), પિન કોડ-૧૨૨૦૫૦ ખાતે થાય છે ત્યારે પુટિને કટાક્ષમાં આમ VITELY CORP LLP નામની એક LLP ને કંપનીઓ અદ્યિનિયમ, ૨૦૧૩ ના અધ્યાય XXI ના ભાગ I હેઠળ શેરો સાથે મર્ચાદિત કંપની તરીકે નોંધણી માટે અરજી કહ્યું હોય તેવું લાગે છે. કરવામાં આવનાર છે. ર.કંપનીના મુખ્ય ઉદ્દેશ્યો આ પ્રમાણે છે:

કંપની લેબોરેટરી, સંશોધન, પ્રયોગ, પરીક્ષણ, નિદાન, તપાસ, સુવિધા અથવા ઢાંચા સ્થાપવા, ચલાવવાના, લીઝ પર આપવાના અથવા લેવાના, જાળવી રાખવાના અને અન્ય કામગીરીઓ ફાર્મા, જેવિક ઉત્પાદનો, ખાદ્ય અને અન્ય ઉદ્યોગો અથવા ક્ષેત્રોને ટેકો આપવા માટે આ તમામ કામગીરી કરવા માટે પ્રવૃત્ત થશે. અને કંપની તેના હેતુની પ્રાપ્તિ માટે જરૂરી અથવા મદદરૂપ અન્ય સેવાઓ, બાબતો અને પ્રવૃત્તિઓ પણ કરશે. શરતે કે કંપની કોઇપણ પ્રકારની બેંકિંગ, વીમા, વેન્ચર કેપિટલ, મ્યુચ્યુઅલ ફંડ, સ્ટોક એક્સચેન્જ, એસેટ મેનેજમેન્ટ અને આવી અન્ય પ્રવૃત્તિઓ લાગુ નિયમનકારી અધિકારીઓની પૂર્વ મંજૂરી વિના નહીં ચલાવે.

3. પ્રસ્તાવિત કંપનીના કરાર અને મેમોરેન્ડમની રૂપરેખા ની નકલ ૪થી મંજિલ, કોમર્સ હાઉસ II, પુષ્પરાજ ટાવરની સામે ટાવર, જજીસ બંગલોઝ રોડ, બોડક્દેવ, અમદાવાદ-૩૮૦૦૫૪, ગુજરાત ખાતે તપાસવામાં આવી શકે છે.

૪.આથી નોટિસ આપવામાં આવે છે, કે જે કોઇ વ્યક્તિ આ અરજી અંગે વિરોધ ધરાવે છે, તેઓએ આ સૂચના પ્રકાશિત થયાના ૨૧ દિવસની અંદર તેમના વિરોધને લેખિતમાં નોંધણી અધિકારીને સેન્ટ્રલ રજીસ્ટ્રેશન સેન્ટર (સીઆરસી), ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોર્પોરેટ અફેરસ (IICA), પ્લોટ નં. ૬, ७, ૮, સેક્ટર ૫, IMT માનેસર, જિલ્લા ગુડગાંવ (હરિચાણા), પિન કોડ-૧૨૨૦૫૦ પર મોકલી શકે છે, તેની નકલ કંપનીની નોંઘાચેલ કચેરીએ મોકલવાની રહેશે.

VITELY CORP LLP #12 **६**स्याक्षर વિજય વિનોદ પટેલ નિર્ણિત ભાગીદાર

ગિરા વિજય પટેલ નિર્ણિત ભાગીદાર તારીખઃ ૦७.૦૯.૨૦૨૪ આગાગમાં આમદાવાદ

જોકે, અંતમાં તેમણે કહ્યું કે

મતદારોએ કરવાની છે. અમે

તેમની પસંદગીને આદર આપીએ

છીએ. પુટિને આ ટિપ્પણી એવા

સમયે કરી છે જ્યારે અમેરિકાએ

રશિયન ન્યૂઝ ચેનલ આરટીના બે

કર્મચારીઓને સજા કરી છે અને

તેના ટોચના એડિટર્સ પર પ્રતિબંધ

ઝિંક્ચો છે. આ પત્રકારો પર

અમેરિકાની ચૂંટણી પર પ્રભાવ

પાડવાનો આરોપ મૂકાયો છે.

ભૂતકાળમાં પુટિને ઘણી વખત આખરી પસંદગી અમેરિકોના

તેમણે હેરિસના હાસ્ય વિશે પણ ફેબ્રુઆરી મહિનામાં પૂટિને

ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે ટ્રમ્પની સામે બાઈડનને ટેકો

તેઓ એવું જોરદાર હસે છે કે તે આપ્યો હતો અને કહ્યું હતું કે

દર્શાવે છે કે તેઓ એકદમ બરાબર અત્યારની સ્થિતિ એ કદમ

ફોર્મ નં. URC-2

છે. તેમણે ટ્રમ્પે અમેરિકા પર આગાહી કરી શકાય તેવી છો.

કંપની અધિનિયમના અધ્યાય XXI ના ભાગ I હેઠળ નોંધણી અંગેની જાહેરાત

ગોખલે રોડ દાદર શાખા. ૭૧, ગોખલે રોડ (એન), પોર્ટગીઝ ચર્ચ પાસે દાદર (૫), મુંબઈ-૪૦૦ ૦૨૮

<u>પ્રધાન કાર્યાલયઃ લોકમંગલ, ૧૫૦૧, શિવાજીનાગર, પુણે-પ</u>

પ્રતિકૂલ પ્રભાવ પાડ્યા વગર કલમ ૧ ૩(૨) હેઠળ ડીમાંડ નોટીસ આરપીએડી/સ્પીડપોસ્ટ/ઇ-મેઈલ દ્વારા

. મે. ઈગો મીડિયા પ્રાઈવેટ લીમીટેડ, પ્લોટ નં. ૦૦૧ એ, કલ્પવૃક્ષ સોસસાયટી, કાલીદાસ હૉલ પાસે એચબી રોડ, મૂલુંડ-૪૦૦૦૮૦

. **શ્રીમતી જાન્હવી કેતન સોનલકર** (ડીરેક્ટર/જામીનદાર), ટી૧/૨૦૧, ફ્લોર નં. ૨જો, રૂંવાલ એન્થુરિયમ લેક્ટર મૂલુંડ (પશ્ચિમ), એલબીએસ માર્ગ, મુંબઈ, મહારાષ્ટ્ર-૪૦૦ ૦૮૦.

**૩. શ્રી કરણ કિરીટકુમાર પૂજારા** (ડીરેક્ટર/જામીનદાર), ઇ-૧૫૩, પાર્શ્વનાથ ટાઉનશીપ, ફેં-૧, શિવમ વિષયાલય નવા નરોડા, અમદાવાદ સીટી, અમદાવાદ, સૈજપૂર બોઘા, ગુજરાત-૩૮૨ ૩૪૫

**૪. શ્રી ભાવેશ પ્રભુદાસ ભીડે (ડીરેક્ટર**) , ફ્લેટ નં. ૧, એનેક્સ કૈલાશ આશિષ, મીરાણી નગર, ડો. આંબેડકર રોડ, મુલુંડ (પશ્ચિમ)-૪૦૦ ૦૮૦

વિષયઃ સિક્યુરાઇટેઝેશન એન્ડ રીકન્સ્ટ્રકશન ઓફ ફાયનાન્સીયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યુરીટી

આથી આપ નં. ૧ને આપની વિનંતીથી અમારા દ્વારા નીચે મુજબ ક્રેડીટ સુવિધાઓ મંજૂર કરવામાં આવેલી છે. આથી આપ નં. ૨,૩,૪ આપના દ્વારા અમારી ગોખલે રોડ શાખા ખાતે લેવામાં આવેલ ક્રેડીટ સુવિધાન ત્રમીનદાર/ ડીરેક્ટર રહ્યા છો

આથી કેડીટ સુવિધાઓની વિગતો, વર્તમાન બાકી લેણાની તરફેણમાં પ્રભારીત કરવામાં આવેલ સીક્યુરી ટીઝની સવિધા નં. ૧ઃ

ક્રમ	ક્રેડીટ સુવિધાનો પ્રકાર અને ૨કમ		સીક્યુરીટી		એનપીએની તારીખ
(٩)	(૨)		(3)		(8)
(٩)	કેશ કે ડીટ ૬૦૩૮૧૧૧૧૭૩૨ લોનની ૨કમઃ રૂા. ૮૦,૦૦,૦૦૦/- (રૂ. એંસી લાખ કંક્ત)	હાયપોથીકેશન બીલ્સ, કેશ કે કોલેટરલ સીક રૂમનં.૯,૧૦ લી. સીટીએસ (પ) મુંબઈન્જ પર્સનલ ગેરેન્ટ ૧. ક્રૂ. જાન્હવી (દીરીકટર/જામ ૨. શ્રી કરણ (	માન અને ભાવિ બંને, સમગ્ર (જેમાં વિવિધ પ્રકારની સામગ્રી શુટ માટે બુક ડેટ્સનો સમાવેશ યુ,૧૧, ગ્રાઉડ ક્લોર, કૈલાશ આ નં. ૧૩૧૪, બેઠી ચાલ, આંબ ૦૦૦૮૦. રો:- કેતન સોનલકર યોનદાર)	ના સ્ટોક, રેનીંગ થાય છે. શિષ સીએચએસ	31-0 <i>2</i> - 2028
આરઑબાઈ	લેજર બેલેન્સ (૦૨.૦૯.૨૦૨૪ના રોજ)		૦૨.૦૯.૨૦૨૪ સુધી અપ્રયોજિત વ્યાજ	૦૨.૦૯.૨૦૨૪ના રોજ કુલ બાકી લેવા	
(ų)	(€)		(૭)	(८)	

રૂા. ૬૭,૫૮,૦૭૧. ૬૪ રૂા. ૩,૦૩,૮૬૪.૯૫ રૂા. ૭૦,૬૧,૯૩૬.૫૯ . આથી લેવામાં આવેલી કેડીટ સુવિધાના બદલામાં, આપે બે કની તરફેણમાં નીચે મુજબ દસ્તાવેજો એક્સ્ઝિક્યૂટ રેલા છે અને ઉપર જણાવ્યા મુજબ પ્રભારીત કરેલા છે તથા સીકગ્રુરીટીઝ ઊભી કરેલ છે

ક્રમ	ના માટે દસ્તાવેજ લેવામાં આવ્યા	દિનાંકિત
૧	આરએફ ૪૬/૪૭-ડીમાંડ પ્રોમિસરી નોટ	20,02,202
ર	આરએફ ૬ દજે-કોંપોઝિટ ડીડ ઓફ હાયપોથી કેશન ફોર ઓલ ફેસીલીટીઝ	20,02,202
3	પ્રસ્તાવિત ઇક્વિટેબલ મોર્ટ્ગેજ માટે મોર્ટ્ગેજરનું ઘોષણાપત્ર	20,02,202
£	આગ્રોક ૧૫૪એ-કૃષ્ટિ અવિધા ત્રિવાય અર્વ અવિધા માટે ગેરેટી	20.02.202

. આથી આપ મંજૂરીના નિયમો અને શરતોનું પાલન કરવામાં નિષ્ફળ ગયા છો અને કસૂર કરેલ છી તથ તદનુસાર રીઝર્વ બેક્ર્રે ઓફ ઈન્ડિયા દ્વારા જારી કરવામાં આવેલ નિર્ધારિત ધોરણો અનુસાર બેન્ક દ્વારા આપન ાતાને એનપીએ તરીકે વર્ગીકૃત કરવામાં આવેલ છે. અમારી વારંવારની માંગણીઓ છતાપણ, આપે આપના ાતામાં બાકી લેણી રકમ ચૂકવેલી નથી.

. આથી ઉપર જણાવેલ એક્ટ હેઠળ બેંકને આપવામાં આવેલ સત્તાઓનો માલ કરતાં. આથી. આ દ્વારા ર નોટીસની પ્રાપ્તિની તારીખથી ૬૦ દિવસોની અંદર સીસી સુવિધા માટે રૂા. ૭૦,૬૧,૯૩૬.૫૯ વત્ત ૦૨.૦૯.૨૦૨૪ના પ્રભાવથી ૧૧.૯૫%ના દરે બિનપ્રયોજિત વ્યાજની પૂરેપુરી ૨કમ પરંત ચૂકવી આપવ ાપને અનુરોધ કરવામાં આવે છે; જેમાં નિષ્ફળ ગયે, ઉપરોક્ત એક્ટની કેલમ ૧૩ની પેટા કેલમ ૪ હેઠળ કોઈપણ અને/અથવા સર્વ સત્તાનો બેક્ર અમલ કરશે જે સંજોગોમાં તે અંગેના સર્વ શુલ્ક, ચાર્જીસ અને ખર્ચ અથવા બન્ય આનુષંગી*ક* ચાર્જીસ ચકવવાને આપ જવાબદાર રહેશો . અન્ય બાબતોની સાથે આ એક્ટ હેઠળ ઉપલબ

તત્તાઓમાં સમાવેશ થાય છે: બે. લીઝ, એસાઈંમેંટ અથવા વેચાણ મારફત ટ્રાન્સફર કરવાના હક્કની સાથે ઉપર જણાવ્યા મુજબ જેમાં સીકયુરીટી ઇન્ટરેસ્ટ ઊભું કરવામાં આવેલ છે તે સીક્યોર્ડ એસેટ્સનો કબજો લેવો બી. લીઝ, એસાઇમેંટ અથવા વેચાણ દ્વારા ટ્રાન્સફર કરવાના હક્ક સહિત સીક્યોર્ડ એસેટસનો વહીવટ સંભાળ

સી. સીક્ચોર્ડ એસેટ્સ જેનો અમારા દ્વારા કબજો લઈ લેવામાં આવેલો છે તેના બંધ માટે મેનેજર તરીકે કોઈપ વ્યક્તિની નિમણૂક કરવી અને મેનેજર સીક્ચોર્ડ એસેટ્સનો વહીવટ કરશે તથા સીક્ચોર્ડ એસેટ્સની ટ્રાન્સફર ાન્સફરીને સીક્યોર્ડ એસેટ્સના અથવા તે સંબંધિત સર્વ હક્કો આપશે, જાણે કે સીક્યોર્ડ એસેટ્સના અથવા હ

સંબંધિત સર્વ હાકો આપના દ્વારા ટ્રાન્સફર કરવામાં આવેલ છે તે રીતે કોઈપણ વ્યક્તિ જેમણે સીક્યોર્ડ એસેટ્સ પૈકી કોઈપણ એસેટ્સ સંપાદિત કરેલ છે જેની સામે સીક્યુરીટી ન્ટરેસ્ટ ઊભું કરવામાં આવેલ છે તેવી વ્યક્તિને આપના પ્રતિ બાકી લેણા અથવા જે બાકી લેણા થવાના છે તે નાણાં અમને ચૂકવી આપવા લકહવું અથવા લેખિતમાં નોટીસ જારી કરવી.

. કપયા નોંધ લેશો કે આ એક્ટની કલમ ૧૩(૧૩) મુજબ, આ નોટીસની પ્રાપ્તિ પછી, અમારી પૂર્વ લેખિત મંજૂરી વગર સીક્યુરીટીઝનો નિકાલ કરવાની અથવા તેનો વ્યવહાર કરવાની આપને મનાઈ કરવામાં આવે છે. . સીકચોર્ડ એસેટ્સને ને પુનઃપ્રાપ્ત કરવા માટે પ્રાપ્ય સમયના સંદર્ભમાં કથિત એક્ટની કલમ ૧૩ની પેટાકલમ્ ૮)ની જોગવાઈઓ પ્રત્યે કરજદારોનું ધ્યાન દોરવામાં આવે છે.

બેન્ક ઓફ મહારાષ્ટ્ર વતી મુખ્ય પ્રબંધક ગોખલે રોડ શાખા

મુંબઈ સાઉથ ઝોન

#### પેટ્રન એક્ઝિમ લિમિટેડ ઃનોટિસ ર જી વાર્ષિક સાધારણ સભા(એજીએમ)ની જાણકારી

પેટ્રન એક્ઝિમ લિમિટેડની ૨જી વાર્ષિક સાધારણ સભા (એજીએમ) સોમવાર,સપ્ટેમ્બ૨ ૩૦, ૨૦૨૪ના રોજ લપોર્ટ ૦૪:૦૦ વાગે કિયનીયારા, ૨૦૧૩ અને એના અન્વયે લનેલ નિયમોને કોર્પોરેટ અર્ફર્સ મંત્રાલય, ભારત સરકાર(એમસીએ)ના સામાન્ય પરિપગો નં.૧૪/૨૦૨૦ , ૧૭/૨૦૨૦, ૨૦/૨૦૨૦, ૦૨/૨૦૨૧ , ૨૧/૨૦૨૧ ૦૨/૨૦૨૨, ૧૦/૨૦૨૨ અને ૦૯/૨૦૨૩ અનુક્રમે તારીખો ૦૮મી એપ્રિલ,૨૦૨૦, ૧૩મીએપ્રિલ,૨૦૨૦ ૦૫મી મે, ૨૦૨૦, ૧૩મી જાન્યુઆરી,૨૦૨, ૧૩મી જાન્યુઆરી,૨૦૨૧, ૧૪મી ડિસેમ્બર,૨૦૨૧, ૦૫મી મે,૨૦૨૨, ૨૮મી ડિસેમ્બર, ૨૦૨૨ અને ૨૫મી સપ્ટેમ્બર,૨૦૨૩(એમસીએપરિપત્રો) અને બાકીના વખતોવખત ૧હાર પડેલ સંબંધિત પરિપત્રો અનુસાર એજીએમના સ્થળે સભ્યોની શારીરિક ઉપસ્થિતિ જરૂરી નથી એના પાલન અર્થે વિડીયો કોન્ફરન્સ (વીસી-VC)/અન્ય ઓડિયોવિઝ્યુઅલ સાધનો("OAVM") દ્વારા એજીએમની નોટિસમાં નક્કી કરેલ સામાન્ય અને વિશેષ વ્યવહારો કરવા માટે યોજાશે. વી સી/ઓવમ દ્વારા સભ્યોનો ભાગ લેવાય તે કંપનીધારા, ૨૦૧ ૭ની ક્લમ ૧૦૩ હેકળ કોરમના હેતુથી રેકોર્ડ કરવામાં આવશે.

ર. ઉપરોક્ત પરિપત્રો અને સેબી પરિપત્ર તા. ૭મી ઓક્ટોબર, ૨૦૨૩ (સેબી પરિપત્ર)ની શરતો મુજબ, વાર્ષિક અહેવાલ ૨૦૨૩-૨૪ સાથે એજીએમની નોટિસ માત્ર ઈલેક્ટ્રિક મોડથી જે સભ્યોના ઈ-મેઇલ એડ્રેસ કંપની પાસે નોંધાયેલ છે તેમને મોકલી અપાશે. આથી વાર્ષિક અહેવાલની ફિઝિકલ કોપી રવાના કરાશે નહીં. ઉપરોક્ત દસ્તાવેજ કંપનીની વેબસાઇટ www.patronexim.com , બીએસઈની વેબસાઇટ www.bseindia.com અને બિગશેર સર્વિસ પ્રાઈવેટ લિમિટેડ(રિમોટ ઈ-વોર્ટિંગની સુવિધા પૂરી પાડનાર એજન્સી)ની વેબસાઇટ https://wote.bigshareonline.com પર પણ ઉપલબ્ધ હશે. એજીએમમાં જોડાવા માટેની સૂચનાઓ એજીએમની નોટિસમાં આપેલ છે. વીસી/ઓવમ દ્વારા મીટિંગમાં ભાગ લેનાર સભ્યોની ગણતરી કંપનીધારા, ૨૦૧૩ની કલમ ૧૦૩ મુજબ કોરમ થવાના હેતુથી ગણતરીમાં લેવાશે. ૩. કંપની તેના તમામ સભ્યોને એજીએમની નોટિસમાં જણાવેલ તમામઠરાવો પર તેમનો મત આપે તે માટે રિમોટ ઈ-

. વીટિંગ સુવિધા '(રિમોટ ઈ-વોટિંગ') પૂરી પાડી રહી છે. વધુમાં, કંપની એજીએમ દરમિયાન ઈ-વોટિંગ સિસ્ટમથી વોટિંગની સુવિધા ('ઈ-વોટિંગ') પણ પૂરી પાડી રહી છે. રિમોટ ઈ-વોટિંગ ઈ-વોટિંગની વિગત વાર પ્રક્રિયા એજીએમની

r. પોતાના ઈમેઇલ એડેસીસ કંપની ડિપોઝીટરીઝ પાસે નોંધાવ્યા ન હોય એવા સભ્યો વાર્ષિક અહેવાલ અને ઈ-વોટિંગ . માટે લોગ ઈન વિગતો મેળવવા માટે ઈ-મેઇલ એડ્રેસ નોંધાવવા માટે મહેરબાની કરીને નીચેની સૂચનાઓનું પાલન કરેઃ અ) ફિઝિકલ મોડમાં શેર પરાવતા સભ્યો માટે- મહેરબાની કરીને જરૂરી વિગતો જેવી કે કોલિઓ નં., શેરધારકનું નામ, શેર સર્ટિફિકેટ(આગળની અને પાછળની બાજુ)ની સ્કેન કરેલ ક્રોપી, પાન (પાન કાર્ડની સ્કેન કરેલ સ્વયંપ્રમાણિત કોપી), આધાર (આધાર કાર્ડની સ્કેન કરેલ સ્વયંપ્રમાણિત કોપી) ઈ-મેઇલ દ્વારા into@patronexim.com અથવ ivote@bigshareonline.comને મોકલી આપવી.

૧) ડિમેટ મોડમાં શેર ધરાવતા સભ્યો માટે- મહેરબાની કરીને ડીપીઆઇડી-સીએલઆઇડી (૧૬ આંકડાના ડીપીઆઇડી સીએલઆઈડી અથવા ૧૬ આંકડાનો લાભાર્થી આઈડી) નામ, ક્લાયન્ટ માસ્ટર અથવા ક્ષેત્સોલિડેટેડ એકાઉન્ટ સ્ટેટમેન્ટની ક્ષેપી , પાન (પાન કાર્ડની સ્કેન કરેલ સ્વયંપ્રમાણિત કોપી) , આધાર (આધાર ક્ષર્ડની સ્કેન કરેલ સ્વયંપ્રમાણિત ક્ષેપી) ઈ-મે ઇલ દ્વારા info@patronexim.com અથવા ivote@bigshareonline.com ને મોકલી આપવી.

લેંકખાતાની વિગતોનું અપડેશન શેરધારકો ને તેમના સંબંધિત ડિપોઝીટરી ભાગી દારોને તેમના બેંક ખાતામાં કેરફારોની નોંધ કરાવી દેવાની વિનંતી છે. ૫. એજીએમની પ્રક્રિયા માટે રેકોર્ડ્સ અને ડેટા

. મતદાન (રિમોટ ઈ-વોટિંગ, એજીએમ અને એજીએમ ખાતે ઈ-વોટિંગ સહિત) માટેના હેતુથી કટ-ઓફ તારી ખ સોમવાર, ૨૩મી સપ્ટેમ્બર, ૨૦૨૪ છે. કોઈ વ્યક્તિ જેનું નામ સભ્યોનાં રજિસ્ટરમાં અથવા પિપોઝીટરીઝ દ્વારા રખાતા લાભાર્થી માલિકોના રજિસ્ટરમાં નોંધાયેલ હોય તેઓ વીસી/ઓવમ દ્વારા એજીએમમાં ભાગ લઈ શકવા અને રિમોટ ઈ-વોટિંગ દ્વારા મતદાનની સુવિધા મેળવવા પાત્ર ગણાશે. સંભ્યોને વિનંતી છે કે એજીએમની નોટિસમાં આપેલ તમામ નોંધો અને ખાસ તો , એજીએમમાં જોડાવા માટેની, રિમોટ ઈ-વોટિંગ દ્વારા અથવા એજીએમ વખતે ઈ-વોટિંગ દ્ગરા મત આપવાની પદ્ધતિ વિશે કાળજીપૂર્વક વાંચી જાય.

લોગ ઇન ઈ-વોટિંગ બાબતે જેમને કોઈ પચ્છા કે સમસ્યા હોય તો તેઓ ivote@bigshareonline.com ને ઈ-મેઇલ

મોકલે અથવા સંપર્ક કરેઃ ૧૮૦૦ ૨૨ પ૪ ૨૨.

તા. દહી સપ્ટેમ્બર, ૨૦૨૪

વતી, પેટ્રન એક્ઝિમ લિમિટેડ સહી/-ભૂમિષ્ઠ પટેલ ડાયરેક્ટર DIN: 02516641

#### એસવીએસ વેન્ચર્સ લિમિટેડઃ ૯મી વાર્ષિક સાધારણ સભા(એજીએમ)ની જાણકારી અંગે નોટિસ

૧.એસવીએસ વેન્ચર્સ લિમિટેડની ૯મી વાર્ષિક સાધારણ સભા (એજીએમ) સોમવાર,સપ્ટેમ્બર ૭૦, ૨૦૨૪ના રોજ ાવારે ૧૧.૩૦ વાગે કંપનીધારા, ૨૦૧૩ અને એના અન્વયે બનેલ નિયમોને કોર્પોરેટ અફર્સ મંત્રાલય, ભાર ક્ષરક્ષર(એમસીએ)ના સામાન્ય પરિયત્રો નં.૧૪/૨૦૨૦ , ૧૭/૨૦૨૦, ૨૦/૨૦૨૦, ૦૨/૨૦૨૧ , ૨૧/૨૦૨૧ ર/૨૦૨૨, ૧૦/૨૦૨૨ અને ૦૯/૨૦૨૩ અનુક્રમે તારીખો ૦૮મી એપ્રિલ,૨૦૨૦, ૧૩મીએપ્રિલ,૨૦૨૦ ગ્યમી મે, ૨૦૨૦, ૧૭મી જાન્યુઆરી,૨૦૨૧,૪મી ક્લિંગ્બર,૨૦૨૧, ૦૫મી મે,૨૦૨૨, ૨૮મી ક્લિંગ્બર !૦૨૨અને૨૫મી સપ્ટેમ્બર,૨૦૨૭(એમસીએ પરિપત્રો) અને બાકીના વખતોવખત બહાર પડેલ સંબંધિત પરિપત્રે નુસાર એજીએમના સ્થળે સભ્યોની શારીરિક ઉપસ્થિતિ જરૂરી નથી એના પાલન અર્થે વિડીયો કોન્ફરન્સ (વીસી-VC) ાન્ય ઓડિયોવિઝ્યુઅલ સાધનો("OAVM") દ્વારા એજીએમની નોટિસમાં નક્કી કરેલ સામાન્ય અને વિશેષ વ્યવહારે વા માટે યોજાશે. વીસી/ઓવમ ઢારા સભ્યોનો ભાગ લેવાય તે કંપનીધારા, ૨૦૧૩ની કલમ ૧૦૩ હેઠળ કોરમન દતથી રેકોર્ડ કરવામાં આવશે.

.ઉપરોક્ત પરિપત્રો અને સેબી પરિષત્ર તા. ૭મી ઓક્ટોબર, ૨૦૨૩ (સેબી પરિષત્ર)ની શરતો મુજબ, વાર્ષિક હેલાલ ૨૦૨૩-૨૪ સાથે એજીએમની નોટિસ માત્ર ઈલેક્ટ્રિક મોડથી જે સભ્યોના ઈ-મેઇલ એડ્રેસ કંપની પાસે ોંધાયેલ છે તેમને મોકલી અપાશે. આથી વાર્ષિક અહેવાલની ફિઝિકલ કોપી રવાના કરાશે નહીં. ઉપરોક્ત દસ્તાવેજ પનીની વેબસાઈટ www.svsventures.co.in, બીએસ ઈની વેબસાઈટ www.bseindia.com અને િ ભગશેર સર્વિસ ાઈવેટ લિમિટેડ(રિમોટ ઈ-વોર્ટિંગની સુવિધા પુરી પાડનાર એજન્સી)ની વેબસાઈટ https://vote.bigshareonline.com . પણ ઉપલબ્ધ હશે. એજીએમમાં જોડાવા માટેની સૂચનાઓ એજીએમની નોટિસ માં આપેલ છે. વીસી/ઓવમ દ્વાર ીટિંગમાં ભાગ લેનાર સભ્યોની ગણતરી કંપનીધારા, ૨૦૧૩ની કલમ ૧૦૩ મુજબ કોરમ થવાના હેતુથી ગણતરીમ

૩.કંપની તેના તમામ સભ્યોને એજીએમની નોટિસમાં જણાવેલ તમામ ઠરાવો પર તેમનો મત આપે તે માટે રિમોટ ઈ-વોટિંગ સુવિધા ('રિમોટ ઈ-વોટિંગ') પૂરી પાડી રહી છે. વધુમાં, કંપની એજીએમ દરમિયાન ઈ-વોટિંગ સિસ્ટમથી વોટિંગની સુવિધા ('ઈ-વોટિંગ') પણ પૂરી પાડી રહી છે. રિમોટ ઈ-વોટિંગ ઈ-વોટિંગની વિગતવાર પ્રક્રિયા એજીએમની નોટિસમાં આપેલ છે.

. પોતાના ઈમેઇલ એડ્રેસીસ કંપની/ડિપોઝીટરીઝ પાસે નોંધાવ્યા ન હોય એવા સભ્યો વાર્ષિક અહેવાલ અને ઈ-વોટિંગ માટે લોગ ઈન વિગતો મેળવવા માટે ઈ-મેઇલ એડ્રેસ નોંધાવવા માટે મહેરબાની કરીને નીચેની સૂચનાઓનું પાલન કરે: અ) ફિઝિક્લ મોડમાં શેર ધરાવતા સભ્યો માટે- મહેરબાની કરીને જરૂરી વિગતો જેવી કે ફોલિઓ નં., શેરધારકનું નામ, શેર સર્ટિકિકેટ(આગળની અને પાછળની બાજુ)ની સ્કેન કરેલ કોપી, પાન (પાન કાર્ડની સ્કેન કરેલ સ્વયંપ્રમાણિત ક્રોપી), આધાર (આધાર કાર્ડની સ્કેન કરેલ સ્વયંપ્રમાણિત ક્રોપી) ઈ-મેઇલ દ્વારા into@svsventures.co.in અથવા

ivote @bigshareonline.comને મોકલી આપવી. લ) ડિમેટ મોડમાં શેર પરાવતા સભ્યો માટે- મહેરબાની કરીને શ્રેપીઆઇડી-સીએલઆઇડી (૧ ૬ આંકડાના ડીપીઆઇડી સીએલઆઇડી અથવા ૧૬ આંકડાનો લાભાર્થી આઇડી) નામ, ક્લાયન્ટ માસ્ટર અથવા ક્રેન્સોલિડેટેડ એકાઉન્ટરસ્ટેટમેન્ટની ક્રેપી, પાન (પાન કાર્ડની સ્ક્રેન કરેલ સ્વયંધ્રમાણિત કોપી), આપાર (આપાર ક્રાર્ડની સ્ક્રેન કરેલ સ્વયંધ્રમાણિત ક્રેપી) ડિમોઇલ દ્વારા into@svsventures.co.in અથવા ivote@bigshareonline.comને મોકલી આપવી

બેં કખાતાની વિગતોનું અપડેશન શેરધારકોને તેમના સંબંધિત ડિપોઝીટરી ભાગીદારોને તેમના બેંક ખાતામાં કેરફારોની નોંધ કરાવી દેવાની વિનંતી છે.

ા. એજીએમની પ્રક્રિયા માટે રેકોર્ડ્સ અને ડેટા બ. મતદાન (રિમોટ ઈ-વોટિંગ, એજીએમ અને એજીએમ ખાતે ઈ-વોટિંગ સહિત) માટેના હેતુથી કટ-ઓક તારીખ શેમવાર, ૨૩મી સપ્ટેમ્બર, ૨૦૨૪ છે. કોઈ વ્યક્તિ જેનું નામ સભ્યોનાં રજિસ્ટરમાં અથવા ડિપોઝીટરીઝ દ્વારા રખાતા તાભાર્થી માલિકોના રજિસ્ટરમાં નોંધાયેલ હોય તેઓ વીસી/ઓવમ દ્વારા એજીએમમાં ભાગ લઈ શકવા અને રિમોટ ઈ ોટિંગ દ્વારા મતદાનની સુવિધા મેળવવા પાત્ર ગણાશે. સભ્યોને વિનંતી છે કે એજીએમની નોટિસમાં આપેલ તમામ નોંધો અને ખાસ તો , એજીએમમાં જોડાવા માટેની, રિમોટ ઈ-વોટિંગ દ્વારા અથવા એજીએમ વખતે ઈ-વોટિંગ દ્વારા મત આપવાની પદ્ધતિ વિશે કાળજીપૂર્વક વાંચી જાય.

શેગ ઇન ઈ-વોટિંગ બાબતે જેમને કોઈ પૃચ્છા કે સમસ્યા હોય તો તેઓ ivote@bigshareonline.comને ઈ-મેઇલ

મોકલે અથવા સંપર્ક કરેઃ ૧૮૦૦ ૨૨ પ૪ ૨૨.

સ્થળઃ અમદાવાદ તા. દહી સપ્ટેમ્બર, ૨૦૨૪

વતી, એસવીએસ વેન્ચર્સ લિમિટે સદ/- શશિકાન્ત વેદપ્રકાશ શર્મા મેનેજિંગ ડાયરેક્ટર DIN: 06628349



### વી.એલ. ઇન્ફ્રાપ્રોજેક્ટ્સ લિમિટેડ

CIN: L45200GJ2014PLC081602 રજિસ્ટર્ડ ઓફિસ: ૭૧૬, શિવાલિક સત્થમેવ, વકીલ સાફેબ બ્રિજની નજીક, બોપલ, અમદાવાદ, ગુજરાત - ૩૮૦૦૫૮

ક્રોન: (૦૨૭૧૭) ૪૦૨૪૯૪ વેબસાઇટ: www.vlil.in ઈમેઇલ: info@vlil.in

### ૧૦મી વાર્ષિક સામાન્ય સભાની નોંધ

આથી સૂચના આપવામાં આવે છે કે ૧૦ મી વાર્ષિક સામાન્ય સભા (AGM) વી.એલ. ઇન્ફ્રાપ્રોજેક્ટ્સ લિમિટેડ ની સોમવારે, 30 સપ્ટેમ્બર, ૨૦૨૪ ના રોજ બપોરે ૦૧:૩૦ વાગ્યે, વિડીયો કોન્ફરન્સિંગ (VC) / અન્ય ઑડિયો વિઝ્યુઅલ માધ્યમો (OAVM) દ્વારા યોજવામાં આવશે, જે કંપનીઝ એક્ટ, ૨૦૧૩ના લાગુ થતા પ્રવધાનોના અનુસાર અને MCA જનરલ સર્ક્યુલર નં. 20/2020ના પેરાગ્રાફ 3 અને ૪ અને સિક્યોરિટીઝ એન્ઠ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા ("SEBI")ના સર્ક્યુલર નં. HO/CFD/CFDPoD-ર/P/CIR/ ૨૦૨૩/૧૬૭ તારીખ ૭ ઓક્ટોબર, ૨૦૨૩ ("SEBI સર્ક્યુલર") અને સમયાંતરે બહાર પાડવામાં આવેલ અન્ય સંબંધિત સર્ક્યુલર(ઓ)ના મર્યાદામાં વ્યવસાયને વ્યવસ્થિત કરવા માટે મળીને સભ્યોની ભૌતિક હાજરી વિના આયોજન કરવામાં આવ્યું છે.

ઉપરોક્ત સર્ક્યુલર મુજબ, ૧૦ મી AGM ની સૂચના અને FY ૨૦૨૩-૨૪ માટેની કંપનીની વાર્ષિક અહેવાલો માત્ર ઈલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા તે સભ્યોને મોકલવામાં આવી છે જેમણે ડિપોઝિટરીઝ અથવા કંપની સાથે પોતાનું ઈમેઇલ આઈડી નોંધાવ્યું છે. AGMની સૂચના અને ૨૦૨૩-૨૪ ની વાર્ષિક અફેવાલ કંપનીની વેબસાઇટ www.vlil.in, સ્ટોક એક્સચેન્જ એટલે કે NSE ઈન્ડિયા (SME Emerge) વેબસાઇટ www.nseindia.com અને સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ (ઈન્ડિયા) લિમિટેડ (CDSL) વેબસાઇટ www.evotingindia.com પર પણ ઉપલબ્ધ છે.

\*ઈ-વોટિંગ માટેના સૂચનો:\*

કંપનીએ તેના સભ્યોને ધારા ૧૦૮, કંપનીઝ એક્ટ ૨૦૧૩ અને સેબી (LODR) ૨૦૧૫ મુજબ રિમોટ ઈ-વોટિંગ સુવિધા પૂરી પાડી છે. રિમોટ ઈ-વોટિંગ માટે કટ-ઓફ તારીખ સોમવાર, ૨૩સપ્ટેમ્બર, ૨૦૨૪ છે. રિમોટ ઈ-વોટિંગ સુવિધા શુક્રવાર, ૨૭ સપ્ટેમ્બર, ૨૦૨૪ સવારે ૦૯:00 વાગ્યાથી શરૂ થઈને રવિવાર, ૨૯ સપ્ટેમ્બર, ૨૦૨૪ સાંજે ૦૫:00 વાગ્યા સુધી ખુલ્લી રહેશે.

જે સભ્યો VC/OAVM માધ્યમ દ્વારા AGM માં ફાજરી આપશે અને રિમોટ ઈ-વોટિંગ દ્વારા મતદાન કરેલ નથી, તેઓ AGM દરમિયાન મતદાન કરી શકશે. સભ્યો AGM માં ભાગ લઈ શકે છે પરંતુ બેઠક દરમિયાન ફરી મતદાન કરવાની મંજૂરી નહીં મળે.

કેવી રીતે મતદાન કરવું તે સંબંધિત સંપૂર્ણ સૂચનાઓ AGMની સૂચનામાં સમાવેશ થયેલ છે. જો કોઈ વ્યક્તિ AGMની સૂચના મોકલ્યા પછી શેર ધારક બને છે અને કટ-ઓફ તારીખે શેર ધરાવે છે, તો તે વ્યક્તિ AGMની સૂચના અનુસાર ઈ-વોટિંગ પ્રક્રિયાનું પાલન કરી શકે છે.

કોઈ પ્રશ્નો માટે, તમે www.evotingindia.com પર શેરધારકો માટેની વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs) અથવા ઈ-વોટિંગ યુઝર મેન્યુઅલનો ઉલ્લેખ કરી શકો છો, અથવા CDSLના શ્રી રાકેશ દલવીનો સંપર્ક કરી શકો છો. ઈમેઇલ: helpdesk.evoting@cdslindia.com અથવા ટોલ ફ્રી

નં. ૧૮૦૦ ૨૧ ૦૯૯૧૧ પર કોલ કરી શકો છો. વી.એલ. ઇન્ફ્રાપ્રોજેક્ટ્સ લિમિટેડ

તારીખ: ૦૭ સપ્ટેમ્બર, ૨૦૨૪ અંજલિ મુકેશભાઈ સમાણી કંપની સેક્રેટરી અને કંપ્લાયન્સ ઓફિસર સ્થળ: અમદાવાદ







તારીખ: ૦૫.૦૯.૨૦૨૪













